

# અણજ સમાધિ ભલી

(માંદગીમાં સમતા અને સમાધિ ટકાવી રાખતા પ્રેરણાત્મક પત્રોનો સંગ્રહ)

વૈરાગ્યરત્નિકા



# સહજ સમાધિ ભલી

(માંદગીમાં સમતા અને સમાધિ ટકાવી રાખતા  
પ્રેરણાત્મક પત્રોનો સંગ્રહ)

મુનિ વૈરાયરતિ વિજય

નામ	: સહજ સમાધિ ભલી
વિષય	: માંડગીમાં સમાધિ આપતા પત્રો (ઉપદેશ)
લેખક	: મુનિશ્રી વૈરાગ્યરત્ન વિજયજી
પ્રકાશક	: શુભાનિલાલા રિલીઝ્યુસ ટ્રેસ્ટ
આવૃત્તિ	: દ્વિતીય આવૃત્તિ - ઓક્ટોબર ૨૦૧૫,
પ્રત	: ૧૦૦૦
મૂલ્ય	: રૂ ૬૦-૦૦
પ્રાપ્તિસ્થળ	: શ્રુતભવન સંશોધન કેન્દ્ર ૪૬/૪૭ અચલ ફાર્મ, સર્ચયાઈ માતા મંદિર પાસે, કાત્રજ હિલ, પુણે-૪૬ ૦૨૦-૬૪૭૦૨૧૧૯ (સવારે ૮ થી ૩)
	: શ્રુતભવન સંશોધન કેન્દ્ર (અમદાવાદ શાખા) ૩મંગ શાહ અ/૨૦૪ તીર્થરાજ કોમ્પ્લેક્સ એલિસબ્રીજ, માદલપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૬
	ફોન : ૦૭૯-૨૬૫૭૬૩૬૭
મુદ્રણ	: નૂતન આર્ટ, અમદાવાદ

## પ્રકાશકીય...

માંગીમાં મનને સ્વસ્થ રાખવું બહુ અધુરું છે. શરીરની તકલીફ દવાથી ઓછી કરી શકાય પણ મનની વેદના ઓછી કરવા સમજાળની સાચી દિશા જોઈએ. બિમારીમાં મનને પ્રસત્ર રાખવાના ઘણાં પુસ્તકો છે. પ્રસ્તુત પુસ્તક મનને સ્વસ્થ રાખવાની સુંદર પ્રેરણા આપે છે.

આ પત્રોના પઠનથી અનેક લોકોએ મનની શાતા મેળવી છે. વધુને વધુ લોકો પોતાના મનને સમાધિમાં રાખી શકે એ આશયથી તેને પ્રકાશિત કરતા અમે આનંદ અનુભવીએ છીએ.

શુભાભિલાખા રિલીઝયસ ટ્રસ્ટ  
શ્રુતભવન સંશોધન કેન્દ્ર  
અમદાવાદ-પુણે

## સમર્પણ પત્ર

અંધકારમાંથી અજવાળામાં લઈ જાય એ ગુરુ !  
ગુરુ કોઈના ન હોવા છતાં સહુનાં હોય છે.  
એમના પ્રેમની પરબનું પાણી સહુ કોઈ પી શકે છે.  
ગુરુની ગુરુતાનું ગૌરવ જેવું તેવું નથી.  
ગુરુની એક જ નજર કે એમનું એક જ કૃપા-કિરાણ ભવોભવનું દારિદ્ર ફેડવા  
સમર્થ છે.

સેવ્ય બનવાનું સૌભાગ્ય, સેવક થયા વિના જાગૃત થતું નથી. એ સુષુપ્ત  
સૌભાગ્યની જાગૃતિનો એકમાત્ર ઈલાજ છે, સુગુરુ-સેવા !

ગુરુ ચરણે જીવન સમર્પણ કરવું તેમાં જ જીવનની સાર્થકતા છે.  
સદગુરુના સમર્પણથી વ્યાધિમાં સમાધિનો પ્રત્યક્ષ અનુભવ જેમના બોધવયનો  
દ્વારા થયો તે ગુરુદેવશ્રીના પવન કરકમલોમાં આ નાનકડાં સુકૃતનું સાદર...

અર્પણ... સમર્પણ...

શ્રીમતી કીર્તિબેન નિરંજનભાઈ મોઢી (મુંબઈ)

શ્રીમતી પ્રમોદાબેન ચિત્રભાનુજી (મુંબઈ)

શ્રીમતી અરુણાબેન ભરતભાઈ શાહ (પુના)

## મારી વાત...

ઈ.સ. ૨૦૧૦માં પર્યુષાગ દરમ્યાન મને પેટનો દુઃખાવો ઉપડ્યો. ડૉક્ટરોને બતાવ્યું. પરીક્ષાગો થયાં. આખરે આંતરડામાં અલ્સર છે, તે દૂર કરવા ઓપરેશન કરવું જરૂરી છે તેવો ડૉક્ટરનો અભિગ્રાય આવ્યો. મને પૂછવામાં આવ્યું. મે રાજ્યભૂશીથી હા કહી. ઓપરેશન તો સારી રીતે થઈ ગયું પણ બધાના ચહેરા પર ચિંતા દેખાતી હતી તેથી મને થયું કે ‘કંઈક છે.’

એક દિવસ મારા ખાસ મિત્ર અને પરિવારના ચિકિત્સક ડૉ. શિરીષભાઈ શાહ આવ્યા. મને કહ્યું કે - ‘તને કેન્સર હતું. તેની ગાંઠ તો કાઢી નાખી છે પણ તે આગળ ન વધે તે માટે કિમોથેરપી લેવી પડશે. આ ક્ષેત્રના બીજા નિષ્પાત ડૉક્ટરોની પણ આ જ સલાહ છે કે કિમોથેરપી લેવી જરૂરી છે.’ આ સાંભળીને થોડીક કાણો માટે હું સુનમુન થઈ ગઈ. આખા શરીરમાં ભયનું લખલખું ફરી વળ્યું અને હું રડી પડી. શિરીષભાઈએ મને રડવા દીધી. ધોરે રહીને મને સમજાવ્યું કે - ‘આ ટ્રીટમેન્ટથી તારી જુંદગીના બાકીના વર્ષો તું સ્વસ્થતાપૂર્વક જીવી શકીશ. નિર્ણય હું તારી પર છોંદું છું.’ એ જ કાણે મગજમાં એક ચમકારો થયો. વીર પ્રભુના વચનો યાદ આવ્યા ‘પરિસ્થિતિનો સ્વીકાર કર, સામનો નહિ.’ આ વચનો મારી નવ મહિનાની માંદગીમાં દીવાદંડી સમાન હતા. હું તરત જ સ્વસ્થ થઈ ગઈ અને પરિસ્થિતિને સ્વીકારી લીધી. શિરીષભાઈને કહ્યું કે - ‘હું કિમોથેરપી માટે તૈયાર છું.’ મારા પતિ, મારા બબે દિકરાઓ પ્રણવ-મૌલિક અને મારી વહુ પ્રાંશુ બધા હાજર હતા. મારા આ હિંમતભર્યા નિર્ણયથી બધાને જ હાશ થઈ. મને આ વિચાર આવી શક્યો અને સ્વસ્થતા ટકી શકી તેનું કારણ - સુબોધભાઈ. પેંદર વરસ તેમની પાસે વિવિધ શાસ્ક્યોનો સ્વાધ્યાય કરેલો તેને કારણે ધર્મની પરિપક્વ થયેલી સમજાણ અને પ્રગાહ શ્રદ્ધા મારી સમાધિનું મૂળ બની રહી.

આ જ અરસામાં મને એક બીજો લાભ મળ્યો હતો. મારો પ્રભગ પુણ્યનો ઉદ્ય કે છેલ્લા ત્રાણ વરસથી પૂરુદેવ શ્રી વૈરાગ્યરતિ વિજયજી મહારાજ પૂનામાં જ બિરાજમાન

હતા. તેમની પાસે નિયમિત વ્યાખ્યાન અને વાંચનનું શ્રવણ કરવા જવાનું બનતું. કિમોથેરેપી લેવાનો નિર્ણય કરવા તુરેંત અમે બને (હું અને મારા પતિ ભરતભાઈ) તેમની પાસે ગયા. તેમને બધી જ વાત કરી. ત્યારે પણ હું સ્વર્ણ હતી. એમણે બધું સાંભળીને કહ્યું કે - ‘તમારો નિર્ણય એકદમ યોગ્ય છે. દેવ-ગુરુ-ધર્મની કૃપાથી તમે આમાંથી બહાર આવી જશો.’ ગુરુદેવના વચનોથી મને ખૂબ શાંતા વળી. તેમના સંદ્રભાવથી પારાવાર પ્રેરણા મળી.

એક જ વિચાર આવ્યો કે - ‘રોગ આવ્યો છે પણ તેને કારણે મારી સમાધિ ન તૂટે અને મારા લીધે બીજા કોઈને જરાય પણ તકલીફ ન પડે, એટલી સ્વર્ણતા મળે તો બસ.’

કિમોથેરેપીને આગલે દિવસે હું ગુરુદેવના આશીર્વાદ લેવા અને માંગલિક સાંભળવા ગઈ. મેં તેમને વિનંતી કરી કે - ‘હું મારું અહીં આવવું મુશ્કેલ છે. મારી સમતા અને સમાધિ ટકાવી રાખવા માટે આપના પ્રેરણાદાયક પત્રોની જરૂર છે. ઓપરેશન વખતે આપે જે થોડા બોધદાયક પત્રો લાભેલા તેવા જ આત્મલક્ષી પત્રોની મને જરૂર છે.’ અને આમ શરૂ થઈ પૂછું ગુરુદેવના પત્રોની શૃંખલા.

એ દરમ્યાન મારા ગુરુજી પૂર્ણ સાધીજી શ્રી હરિભાશ્રીજી ત્યાં બિરાજમાન હતા. મહાતપસ્વી અને સૌભ્યતાની મૂર્તિ. તેઓની મારા પર ઘણી સંદ્રભાવના છે. જ્યારે જ્યારે તેઓ મારા મસ્તક પર વાસક્રોપ નાખી હાથ ફેરવતા ત્યારે મારા તન અને મનમાં અદ્ભુત શાંતિ અને સમતા પ્રસરતા. તેમના શિષ્યા પૂર્ણ સાધીજી શ્રી જિનરત્નાશ્રીજી તો ખૂબ ગ્રેમાળ છે. મારી બિમારીનું સાંભળીને મારા માટે તેઓ સતત જાપ જપતા. પૂર્ણ સાધીજી ગુરુપોજ્જવલાશ્રીજી અને બને નાના પૂર્ણ સાધીજીની આંખોમાં મારા માટે સંદ્રભાવ અને પ્રેમ દેખાય છે. મારા દિલમાં તો મારા પૂર્ણ ગુરુદેવ અને પૂર્ણ ગુરુજી સદાય બિરાજમાન છે પણ એ લોકોના દિલના એક ખૂશામાં મારું સ્થાન છે તે મને આ માંદગીમાં જાણવા મળ્યું. કેવું અહોભાગ્ય !

કિમો ચાલુ થઈ. એની આડઅસરો અને વેદનાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો. ખોરાક ન લેવાય. કીમોના પહેલા ત્રણ દિવસ તો તદ્દન બેચેનીમાં વીતે. રાત્રે ઊંઘ ન થાય. દિવસે ચેન ન પડે. કોઈ સાથે વાત કરવાનું ન ગમે. ત્રણ દિવસની વેદના પછી રાહતના દિવસો પૂરા થાય ન થાય ત્યાં બીજી સાયકલ ચાલુ થાય. કેન્સર કરતાં કિમોથેરેપી વધુ

પીડાદાયક છે આ પીડામાંથી હું ગુજરી છું. મારા સદનસીબે આ સમયમાં ગુરુદેવ મારી નજીક બિરાજમાન હતા. તેમના શાંદો મારા કાનમાં સતત ગુંજતા હતા ‘રોગની થતી વેદનાને દવાથી શમાવી શકાય પણ રોગનું મૂળ કારણ કર્મ છે તેને દૂર કરવાની દવા એક જ ડોક્ટર પાસે છે અને તે છે - આપણે પોતે. આપણા કર્મો આપણે જ ભોગવવાના છે, આ વાત સાચી છે તેમ આપણા કર્મો પણ આપણે જ ખપાવવાના છે.’ પૂર્ણ ગુરુદેવના મારી ઉપર અનન્ય ઉપકરો છે. હું દુર્ધ્યાનમાં સરી ન જાઉં, આર્તધ્યાનથી મારો આત્મા લેપાય નહિ તેની તેઓ સતત કાળજી રાખતા. ‘હું દેહ નથી, સર્વશક્તિમાન આત્મા છું.’ આ અહેસાસ પત્રો દ્વારા પૂર્ણ ગુરુદેવ હરહંમેશ કરાવતા.

કિમોથેરપી સાથે રેડિઅશન ચાલુ થયું. વેદના અને પીડા વધતા ચાલ્યા. રેડિઅશન માટે રૂમમાં એકલા જ એકદમ સ્થિર સૂઈ રહેવાનું. પૂર્ણ ગુરુદેવ કંબું હતું કે - ‘એ વખતે નવકાર મહામંત્રના એક એક અભ્યરને છૂટા પાડી તેનું રંગ મ્રમાણો ચિંતન કરજો.’ પહેલા હું અંતઃકરણથી બધા જીવોને ખમાવતી. તેમનું મંગલ અને કલ્યાણ દીર્ઘતી. તે પછી નમસ્કાર મહામંત્રનું ચિંતન કરતી. મન ખરેખર એકદમ શાંત થઈ જતું. કોઈ જાતના વિકલ્પો નહિ. કોઈ જાતનો ભય નહિ. મન હળવું ફૂલ થઈ જતું. આ અવસ્થામાં મને એક મોટામાં મોટો ફાયદો એ થયો કે - નવકારમંત્ર મારા અસ્તિત્વના રોમેરોમમાં વ્યાપી ગયો. ગમે તેવી વેદનામાં પણ સતત નવકારમંત્રનું રટણ ચાલુ જ રહેતું. મન ભટકે નહિ અને આર્તધ્યાનમાં સરે નહિ તેના માટે નમસ્કાર મહામંત્રનું આલંબન અદ્ભુત છે. અચિંત્ય શક્તિ એ મહામંત્રમાં છે. આ બધું અનુભવગમ્ય છે.

પ્રભુને રોજ પ્રાર્થના કરતી ‘હે ! પરમાત્મા ! મારું મન દુર્ધ્યાનમાં જાય ત્યારે આવીને મારો હૃથ જાલી લેજો. મારે આર્તધ્યાન કરીને નવા તીવ્ર કર્મો નથી બાંધવા. હે ! અરિહંત દેવ ! મને સાંભળી લેજો. કોઈ પણ સ્વરૂપે તમારી હાજરીનો અહેસાસ કરાવજો.’ આ બધા શુભ વિચારો વેદના દરમ્યાન મને સ્વસ્થ અને સમતામય રાખતા. કેવળી પ્રરૂપિત ધર્મ ઉપરની મારી પ્રગાહ શર્દીએ જ મને માનસિક તાકાત આપી છે.

મારા પતિએ મારી ખૂબ સેવા કરી છે. પડળાયાની જેમ મારી સાથે રહ્યા છે. તેમના સકારાત્મક વિચારોએ મને માનસિક અને શારીરિક બળ આપ્યું છે. મારા બને દિકરાનો પ્રાણવ અને મૌલિક મને પુષ્ટ પ્રેમ અને હિંમત આપી છે. મારી વહુ પ્રાંશુએ પણ દીકરીની જેમ મારી કાળજી કરી છે. મારી બાહેન પ્રમોદા મારી દરેક કિમો વખતે મુંબઈથી આવી જતી. એક મા કરે એવી સેવા એણે કરી છે. માદગી વખતે મને પૌષ્ટિક ખોરાક મળે એના માટે એણે બહુ જહેમત ઊઠાવી છે. મને ખૂબ હુંક આપી છે. ગુરુદેવ ચિત્રભાનુજીની આત્મચિંતન ભરી વાતો જે તેઓ ફોન દ્વારા કહેતા તે ખૂબ જ પ્રેરણાદાયી અને આત્મબળ વધારનારી હતી. બધા કુટુંબીજનોના પ્રેમ અને હુંકથી જ હું આ માંદગમાં સતત સમતામયી રહી શકી.

અમારા ખાસ મિત્ર ડૉક્ટર શિરીષભાઈનો ખૂબ જ સાથ હતો. તેમની બધે બહુ ઓળખાણ છે. એમના માર્ગદર્શનથી અમે સાચા નિર્ણયો લઈ શક્યા હતા. મારી નાની મોટી શારીરિક તકલીફોનો યોગ્ય ઉપયાર કરતા. તેમના રોજ ફોન આવતા. બે ત્રણ દિવસે આવીને તપાસી જતા. અદ્ધી રાતે પણ હાજર રહેતા. પરીક્ષાણોથી લઈને આજ સુધી સતત તેઓ કાળજી લઈ રહ્યા છે. તેમના માર્ગદર્શનથી મારે ક્યારે પણ મુંઝાવું નથી પડ્યું. હું અને મારો પરિવાર તેમનો આભાર માનીએ તેટલો ઓછો છે.

જુંગામાં પહેલીવાર મે અહેસાસ કર્યો, અનુભવ કર્યો કે - ‘આપણા ગુરુની કૃપાદિશ શું શું ચ્યાતકાર કરે છે.’ ગંભીર દર્દનો સામનો કરવાની હિંમત આવી. ઉપરાંત કેન્સરની વ્યાધિનો સ્વીકાર કરવાની શક્તિ મળી. નવ મહિનાની બીમારીમાં મને મળવા આવેલા કુટુંબીજનો સગાસંબંધી અને મિત્ર પરિવાર મને જોઈને કહેતા કે ગજબની સ્વસ્થતા અને સમતા રાખી છે. આ સાંભળીને મારી અરિહંત દેવ - સદગુરુ અને કેવલી પ્રરૂપિત ધર્મ પરની શ્રદ્ધા વહુ દૃઢ થઈ ગઈ છે. એક વાત છે કે - આ સમતા અને સ્વસ્થતા બહુ સહજતાથી આવતી હતી.

પૂ. ગુરુદેવના સદ્ભાવથી પારાવાર પ્રેરણા મળી. તેમના શબ્દોની સંજીવનીના સહારે જ હું કેન્સર જેવી વ્યાધિની ત્રાસદાયક પીડામાંથી ઓછામાં ઓછી તકલીફ ઉગરી ગઈ.

કેન્સર કરતાં કેન્સરનો ભય વધુ ખતરનાક છે. આ પત્રોએ મારા આત્માને, બળ અને પ્રેરણા આપ્યા છે. જેમને આ પત્રો વાંચવા આપ્યા તે દરેકને પણ શાંતા અને સમાધિનો અનુભવ થયો. તે જોઈ ગમતાનો ગુલાલ કરવાનું મન થયું. જે આ પુસ્તિકાના રૂપે આપના હાથમાં છે. એક પણ વ્યક્તિને આ પત્રના વાંચન દ્વારા હાશકારો થશે તો ખૂબ આનંદ થશે.

- અરુણા ભરત શાહ

## શુતપ્રેમી

સ્વ. શાંતિલાલ વાડીલાલ શાહ

ધર્મિલાબેન હરેનભાઈ શાહ

સનેહલભાઈ રતિલાલ શાહ

મનીષભાઈ લલિતકુમાર કામદાર

કંકુચંદ મગનલાલ શાહ

રસિકલાલ છનાલાલ શાહ

વસુમતીબેન બાબુલાલ શાહ

અશ્વિનભાઈ અમૃતલાલ સંઘવી

ફાતિમાનગર-પૂરો

॥ એ ॥

ધર્મલાભ.

શરીર રોગોનું ધર છે. તેનો સ્વભાવ જ એવો છે.

રોગની સારામાં સારી સારવાર શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન છે. રોગથી ડરી જશો તો તે વધુ પરેશાન કરશો.

પરમાત્માએ ભાવેલી કરુણા ભાવનાથી મનને ભાવિત કરશો. નિરંતર કરુણાની ધારા રોગના સ્થાને સહેદ પ્રકાર રૂપે ફેલાઈ રહી છે તેવો અનુભવ કરશો તો ચોક્કસ રાહૃત મળશો.

વિશેષ ચિંતા કરતા નહીં.

લોગસ્સની બે ગાથા ગણશો

કીત્તિયવંદિયમહિયા જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા ।  
આરુગાબોહિલાભ્ સમાહિવરમુત્તમ દિંતુ ॥

ચંદેસુ નિમ્મલયરા આઇચ્ચેસુ અહિયં પયાસયરા ।  
સાગરવરગંભીરા સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ ॥

॥ એ ॥

### ધર્મલાભ.

જાગી ગયા ? તમારું ઓપરેશન સારી રીતે થઈ ગયું છે. રોગનું કારણ દૂર થયું છે.

થોડી અશક્તિ અને પીડા અનુભવાતી હશે. મન પ્રસન્ન હશે. થોડી નર્વસનેસ જણાશે પણ તે સહજ છે. તમે જે સ્વસ્થતા અને હિંમત કેળવી છે તેને ટકાવી રાખવાની છે.

શ્રી અરિહંત પરમાત્માની શીતલ અને શેત (સફેદ) કરુણાધારા દ્વારા રોગગ્રસ્ત અંગને પવિત્રતા અર્પવાની છે. આ પ્રયોગ ચાલુ રાખશો.

મનને સતત મૈત્રી વિ. ભાવનામાં વ્યસ્ત રાખશો... મૈત્રી ભાવનું પવિત્ર જરણું... ગાયા કરશો. મનને ખૂબ શાતા મળશે.

પીડા થાય ત્યારે પૂર્વના મહાપુરુષોને યાદ કરશો. ભયાનક પીડામાં તેઓ શું વિચારતા હશે ? તે ઉપર વિચાર કરશો.

આ વેદનામાંથી બહાર આવવાનું

વેદનાને સહન કરવાનું

વેદનામાં સમાધિ ટકાવી રાખવાનું સત્ત્વ

તમને મળી રહે એ જ શુભકામના.

॥ એં ॥

ધર્મલાભ.

વિદ્યાર્થી આખું વરસ મહેનત કરે છે પરીક્ષાના દસ દિવસ માટે.

વેપારી આખું વરસ મહેનત કરે છે સીજનમાં કમાણી કરી લેવા માટે.

પરીક્ષાના અને સીજનના દિવસો જ ભવિષ્યની દિશા નક્કી કરે છે.

તમે આજ સુધી જે ધર્મ સમજ્યા છો, જે ધર્મ આચર્યો છે તેને અમલમાં મૂકવાનો આ સમય છે. આ સમયમાં તમે સાવધાન બનજો એમ નહીં કહું, સહૃજ બની રહેજો એમ કહીશ. તમારા મનમાં લેશ પણ ભય નથી એ ખૂબ સારી નીશાની છે. ભય કોને હોય ? અનાથ વ્યક્તિને ભય હોય. અસમજ વ્યક્તિને ભય હોય. તમે રોગને સ્વીકારી લેવા માટે તૈયાર છો. શરીરનો સ્વભાવ છે - બગડવાનો. તેનું એક બગડલું અંગ દૂર થશો. તમે ફરી સ્વસ્થ બની જશો.

તમે હમણાં જ શ્રી આનંદાનજી મહારાજના પદોના અર્થચિંતનમાંથી ગુજર્યા છો. તેમના શબ્દોને યાદ કરશો. તેમના સ્વભાવને યાદ કરજો. તેમની સહૃજ આત્મજાગૃતિને યાદ કરજો. ‘આ રોગ કે પીડા ભૂતકાળની ભૂલનું પરિણામ છે. તે કર્મ ખપાવવા આવ્યા છે. તે તેનું કામ કરશો હું માઝું કામ કરીશ... મારા આત્માને યાદ કરીશ.’ આ ભાવનાને આત્મસાતું કરજો.

દેહ ડાક્ટરને

દિલ પ્રભુને

ચિંતા બીજાને અને

મન ધર્મને સોંપી દઈ

તમે પરમ સમાવિ પૂર્વક

અશાંતાના ઉદ્યને પસાર કરી જાઓ

એ જ શુભકામના

આ.સુ. ૧.

॥ એઁ ॥

### ધર્મલાભ.

એકમના દિવસે તમારી માનસિક સ્વસ્થતા અને પ્રસંગતા જોઈ અપાર આનંદ અનુભવ્યો.

તમારા શરીરમાં વેદના છે પરંતુ તમે તેને મક્કમ મનથી સહન કરો છો. આ મક્કમતા જ સમાધિનો પાયો છે.

તમે જે આરાધના કરવાના ભાવ રાખો છો તેને વધુ મજબૂત કરવાની કોશિશ કરશો. હુમાણાં થોડો સમય શરીરથી આરાધના થઈ શકશો નહીં તો મનથી આરાધના કરશો. તેનાથી ખૂબ લાભ થશે.

રોગ શરીરમાં છે. પીડા શરીરમાં છે. શરીર આપણા હૃથમાં નથી. પણ મનને આપણે વાળી શકીએ છીએ. તમે તમારા મનને સારા કામમાં વ્યસ્ત રાખશો. સતત ધ્યાન, જાપ, વાંચન કરશો. મન પર વધુ દબાણ પણ કરશો નહીં. સહજતાથી જેટલી સાધના થાય તે કરશો.

તમે જલ્દી સારા થઈ જાવ અને વાચના માટે આવવાનું ચાલુ કરી દો એ જ ભાવના રાખું છું.

૧૦-૧૧-૧૦

॥ એ ॥

### ધર્મલાભ.

શાચ્વમાં ઉદાહરણ આવે છે. સનતકુમાર ચક્રવર્તિનું. તેમનું રૂપ જોવા દેવ આવ્યા. દેવ દ્વારા ખબર પડી કે બહારથી સશક્ત અને સુંદર દેખાતા શરીરમાં એક સાથે સાતસો રોગ ઊભા થઈ ગયા છે. આ રોગો વર્યે જ દીક્ષા લીધી. સાધનાથી એવી શક્તિ મળી કે તેમના ધૂંકથી ભયાનક રોગ મટી જાય. પોતાની લબ્ધિનો ઉપયોગ પોતાના રોગ દૂર કરવા ન કર્યો. કોઈએ સવાલ કર્યો. ‘આટલી લબ્ધિ છે તો તમારા રોગ કેમ સહુન કરો છો ?’ જવાબ આપ્યો. ‘હું રોગ સહુન નથી કરતો કર્મ સહુન કરું છું. લબ્ધિનો, દવાનો ઉપયોગ કરી રોગ મટાડી દઈશ કે ઘટાડી શકીશ. કર્મોને કેવી રીતે મટાડીશ ?’

આ દસ્તિ છે, મહાપુરુષોની. શરીરના રોગને તેઓ કર્મરોગની દવા બનાવી દે છે. તેમની નજર શરીર ઉપર નથી, આત્મા ઉપર છે. તેમની ઈચ્છા રોગ દૂર કરવાની નથી. કર્મ દૂર કરવાની છે. સાચી દસ્તિના પ્રતાપે તેમના મનની પ્રસંગતા અકબંદ રહે છે.

તમે તમારા રોગને સહજતાથી સ્વીકાર્યો છે. તેથી જ તમે આટલી હૃળવાશ અનુભવી શકો છે. થોડા દિવસ ખાવાનું નથી તેથી તકલીફ પડશો પણ સનતકુમાર મહર્ષિના વિચારને આત્મસારૂ કરશો તો તમને નવું બળ મળશે.

શ્રદ્ધાનું બળ તમને સદા પ્રસંગ રાખે એ જ મંગલ કામના.

॥ એ ॥

ધર્મલાભ,

રામાયાળની બહુ પ્રસિદ્ધ ઘટના છે. રાણી કૌશાલ્યાએ રાજી દશરથને માથાનો સફેદ વાળ બતાવી કહ્યું : 'જૂઓ દૂત આવ્યો છે. આ દૂત સદેશો લાવ્યો છે કે હવે શરીર નબળું પડ્યું છે, ઘડપણ આવશે. રોગ થશે. હું તમને આગોતરી ખબર આપું છું. જે સાધના કરવી હોય તે કરી લો. તમારી પાસે હજુ સમય છે, શક્તિ છે. કાલે કદાચ શક્તિ નહીં બચે. રોગ, ઘડપણ અને મૃત્યુ તમારી શક્તિને હરી લેશો. તે પહેલા સમયનો અને શક્તિનો સફુપયોગ કરી લો.'

નદીની ગતિ સાગર છે

શરીરની દિશા મૃત્યુ છે

આત્માની દિશા પરલોક છે

તમારા ભૂતકાળના કર્મોએ તમને વ્યાધિ અને વેદના આપ્યા છે તે સાથે જ તમને સહુન કરવાની શક્તિ અને સમજણ પાણ આપ્યા છે. તમે સમાધિ અને બોધિ જાળવી શકો તેવા સંયોગ પાણ આપ્યા છે. તેનો ઉપયોગ કરવાની તક તમારી સામે છે. તમારી સમજણને સમાધિમાં ફેરવવાની છે.

ગમે તેટલા પ્રયાસ કરો મૃત્યુ ટાળી શકાતું નથી. રોગથી થતી વેદનાને દવાથી શમાવી શકાય પાણ રોગનું મૂળ કારણ કર્મ છે તેને દૂર કરવાની દવા એક જ ડોક્ટર પાસે છે અને તે છે - આપણે પોતે. આપણા કર્મ આપણો જ ભોગવવાના છે, આ વાત સાચી છે તેમ આપણા કર્મ ખપાવવાના પણ આપણો જ છે.

આપણા રોગને આપણે કર્મ ખપાવવાનું સાધન બનાવી દઈએ તો આપણા જેવું ડાબું કોઈ નહીં. જેરથી જ જેરનું મારણ થઈ જાય.

આ માટે તમારે તમારા રોગને દવા બનાવવો રહ્યો.

શરીરની ચિંતા ડોક્ટરને સોંપી દઈએ.

મનની ચિંતા સ્વજનોને સોંપી દઈએ.

આત્માની ચિંતા આપણે કરીએ.

બીજુ તમામ ચિંતાઓ બીજાને સોંપી શકાય છે. આત્માની ચિંતા આપણા સિવાય બીજું કોઈ કરી શકતું નથી. આત્માની શક્તિ વધશે તો મનની શક્તિ વધશે. મનની શક્તિ વધશે તો શરીરની શક્તિ વધશે.

આત્માની શક્તિ વધારવા શ્રી વીરપ્રભુને આલંબન બનાવશો. સાડા બાર વરસના સાધના કાળમાં પરમાત્માએ પારાવાર ઉપસર્ગો સહન કર્યા છે. દરેક ઉપસર્ગ વખતે પરમાત્માના આત્મામાં સમતા, મનમાં સમાધિ અને આંખોમાં કરુણા રહેતી. પરમાત્માની આ અવસ્થાને મનોમન યાદ કરી વંદન કરશો. તમને અનેરું બળ મળશે.

॥ એ ॥

### ધર્મલાભ.

આ દુનિયામાં રોગ ઘણા છે. અસાધ્ય રોગો પણ પાર વિનાના છે. રોગની સારવાર અને દવાઓ પણ છે. શરીરની પીડા ઓછી કરે અને મગજને રોગના પ્રભાવથી દૂર રાખે તેવી દવાઓ પણ શોધાઈ છે.

રોગ પાપના ઉદ્યથી આવે.

રોગની સારવાર પુણ્યના ઉદ્યથી ભળે.

પરંતુ રોગમાં સમાધિ શ્રદ્ધાના સહિતે ભળે.

તમને રોગની સારવાર મળી રહે છે, તે તમારો પુણ્યોદય છે. સાથે જ તમારા અંતરમાં જે શ્રદ્ધાનો ઉદ્ય છે તે ખૂબ અનુમોદનીય છે. તમે જે હિંમતથી રોગનો સ્વીકાર કર્યો છે તેને ધન્ય છે. તમારી નજર સામે આરાધનાનું લક્ષ્ય છે. આ લક્ષ્યને શ્રદ્ધાનું પીઠબળ છે. શ્રદ્ધા મજબૂત બને તેવી સમજણા છે તેથી સમાધિ જાળવવી તમારા માટે મુશ્કેલ નથી.

આ અવસ્થામાં તમારે તમારા મનને ખૂબ સાચવવાનું છે. શરીરની નાની સરખી પીડા મન પર અસર કરી જાય તો આત્મા અસમાધિમાં સરી પડે. શ્રીકૃષ્ણ મહારાજા અને શ્રી શ્રેણિક મહારાજાના કિસ્સામાં તેવું જ બન્યું. એક નાનો દુર્ભણતાનો કે દેખનો વિચાર તેમની સમાધિ હરી ગયો. એટલે મનને નબળા વિચારનો ભોગ બનવા દેવું નહીં. શરીરની અશાતા થોડા સમય બાદ ચાલી જાય છે. પણ મનની અરતિ સહેલાઈથી જતી નથી. માટે શરીરની અશાતા હોય ત્યારે મનને શાંત રાખવા કોશિશા કરવી.

મનને શાંત રાખવા સતત સારું વાંચન, તે ન બને તો નવકાર મંત્રના જાપનું આલંબન લેશો. આંખો બંધ કરી, શરીર શિથિલ કરી, મનને હળવું ફૂલ બનાવી, આંખ સામે નવકાર મંત્રના એક એક અક્ષરને જોવાનો ગ્રયાસ કરવો. તે ન બને તો ધ્યાનપૂર્વક નવકાર મંત્રના અક્ષર સાંભળવા. કોઈ બોલે છે અને હું સાંભળું છું તેવો અનુભવ કરવો. નવકાર મંત્રની શક્તિ અચિંત્ય છે. તે તમને સમાધિમાં રહેવા માટે જરૂર મદદરૂપ થશે.

॥ એ ॥

શાખમાં કથા આવે છે. ઈન્દ્રે દેવો આગળ સનતકુમાર ચક્રવર્તીના રૂપની અને સમજણની પ્રશંસા કરી. દેવો આવ્યા. સ્નાનાગરમાં ચક્રવર્તીની રૂપસંપદા જોઈ માથું ધૂણાવ્યું. ચક્રવર્તી પણ રાજુ થઈ ગયા. પોતાના રૂપનું સહેજ અભિમાન જાગી ગયું. તેમણે દેવોને કહ્યું. ‘મારું શ્રેષ્ઠ રૂપ તો તમને દરબારમાં જોવા મળશે.’ દરબારમાં દેવો આવ્યા. પણ તેમના ચહેરા પર ચક્રવર્તીએ પ્રશંસા ન જોઈ. તેમણે કારણ પૂછ્યું. દેવોએ કહ્યું, ‘પહેલાં તમારું શરીર રોગરાહિત હતું. હવે રોગોથી ઘેરાઈ ગયું છે.’ ચક્રીએ બીજો પ્રશ્ન કર્યો. ‘કેટલા રોગ છે ?’ જવાબ મળ્યો ‘સાતસો જીવલેણ રોગ છે.’ ચક્રીના મનમાં શક્તાપૂર્વકની સમજણ હતી તે જાગી. અનિત્યભાવના જન્મી. તેઓ વિચારવા લાગ્યા.... ‘હજુ બે ઘડી પહેલા મારું શરીર કેટલું સુંદર હતું ? બે ઘડીમાં કરમાઈ ગયું ? આટલી વારમાં સ્વસ્થતા ગાયબ ? આ શરીરનો શું ભરોસો ?

આ પુદ્ગલ કા કયા વિસવાસા

દૈ સુપને કા વાસા...

ચમત્કાર બિજલી દે જૈસા

પાની બિચ પતાસા

યા દેહી કા સંગ ન કરના

જંગલ હોયેગા વાસા

જૂઠે તનધન જૂઠે જોબન

જૂઠે હૈ ઘરવાસા

આનંદધન કહે સબહી જૂઠા

સાચા શિવપુર વાસા...

શિવપુરની સાધના કરવા માટે તેમણે દીક્ષા લીધી. શરીરમાં સાતસો રોગ લઈને સાધના કરે છે. દેવો તેમના સત્ત્વની પરીક્ષા કરવા આવ્યા. કહે છે કે - ‘રજા આપો તો

રોગની સારવાર કરીએ.' રાજર્ષિએ પોતાનું થૂક આંગળીએ લગાવ્યું. આંગળી સોના જેવી થઈ ગઈ. 'દેવ ! મારું થૂક મારા શરીરની દવા બની શકે છે. મારે મન શરીરના રોગની કોઈ ચિંતા નથી. મને શરીર કે મનની દવા જોઈતી નથી. શરીરમાં રોગ જે કારણથી આવે છે તે કર્મની દવા તમારી પાસે હોય તો આપો.' દેવોએ હાથ જોડ્યા કહ્યું 'તેની તો કોઈ દવા નથી.' રાજર્ષિ કહે છે, 'કર્મના રોગની કોઈપણ દવા આ ફુનિયામાં નથી' પરીક્ષા કરવા આવેલા દેવોએ પૂછ્યું, 'તમે આટલા રોગને, વેદનાને, કર્મના ઉદ્યને સહન કેવી રીતે કરો છો ?'

ચક્કીએ કહ્યું, 'ભગવાનના વચ્ચેનોનું ઔષધ છે, મારી પાસે. પ્રભુવચ્ચેનોના નિરંતર સ્મરણથી મને સાચી સમજણ મળી છે. શુદ્ધ શ્રદ્ધા ગ્રામ થઈ છે. સ્થિર સત્ત્વ મળ્યું છે.'

સમજણ, શ્રદ્ધા અને સત્ત્વ

રોગના હુમલા સામે

સ્વસ્થ અને સમાધિસ્થ

રહેવાની તકાત આપે છે

મનને હિંમત આપે છે.

તમને આ ગ્રાણ ગુણ નિરંતર સહાય કરો.

ફા.વ. ૧૩

॥ એ ॥

ધર્મલાભ

સમાધિના ત્રણ સ્તર છે.

શરીરની સ્વસ્થતા

મનની શાંતિ અને

આત્માની સમતા.

શરીરની સ્વસ્થતા જોખમમાં આવે ત્યારે મનની શાંતિ હણાય. મન શાંત ન હોય તો આત્મા સમતામાં ન રહી શકે. શરીરમાં રોગ આવે છે, વેદના થાય છે - કર્મના ઉદ્યને કારણે.

આપણે જે કર્મ બાંધ્યા છે તે એક યા બીજી રીતે ઉદ્યમાં આવવાના છે. આપણી પાસે સમજણ હોય અને મનને શાંત રાખી શકવાની કળા હોય ત્યારે આ કર્મો ઉદ્યમાં આવે તો નવાં ખરાબ કર્મો બંધાય નહીં અને સમજણ દ્વારા કમથી કમ આપણે ભવિષ્યમાં આવનારા દુઃખોને અટકાવી શકીએ. શાંત રહેવાથી તેવાં કર્મો બંધાતા નથી.

મનને શાંત રાખવાનું સૂત્ર છે - વેદનાનો સહજભાવે સ્વીકાર.

મને રોગ છે તેથી પીડા થવાની છે. તકલીફ પડવાની છે. મારી સહુનશીલતાથી વધુ પ્રમાણમાં પીડા થશો તો મારાથી ચીસ પણ પડાઈ જશે. છતાં આ અવસ્થામાં હું શાંત રહેવા પ્રયાસ કરીશા. કેમ કે રોગ મનને અસ્વસ્થ કરી મૂકશો તો પણ હું મારા આત્માને રોગના હુમલાથી બચાવી લેવા માગું છું. રોગ શરીરમાં છે. ઉપયારથી તે જતો રહેશે પણ હું રોગને મારા મન પર સવાર થવા નહીં દઉં. મારા આત્માને જોખમમાં નહીં મુકું.

શરીરના સ્તર પર રોગનો ઈલાજ દવા છે.

મનના સ્તર પર રોગનો ઈલાજ પ્રસન્નતા છે.

આત્માના સ્તર પર રોગનો ઈલાજ આલોચના છે.

દવા રોગને દૂર કરે છે. આલોચના કર્મને દૂર કરે છે.

દવા દર્દને હળવું કરે છે. આલોચના પાપને હળવું કરે છે.

આલોચના આત્માના અશુભ પરિણામોને શુદ્ધ કરે છે. ‘મારું આ કર્મ જે અશુભ પરિણામને કારણે ઉદ્યમાં આવ્યું છે’, તે પરિણામ શુદ્ધ થાય’ આ માટે સતત લોગસ્સ સૂત્રના કાઉસ્સંગ દ્વારા ભગવાનનું ધ્યાન કરવું.

જે જે પાપો યાદ આવે તેને પશ્ચાત્તાપથી ઘોઈ નાંખવા.

જે જે ભૂલો યાદ આવે તેની માર્કી માંગવી.

જે જે આત્માઓનો અપરાધ કર્યો હોય તેની ક્ષમા માંગવી.

આલોચના દ્વારા તમારું અંતર શુદ્ધ બને,

આત્મા નિર્મળ બને,

શરીર સ્વસ્થ બને.

એ જ મંગલકામના.

॥ એ ॥

ધર્મલાભ,

શરીરમાં જ્યારે તીવ્ર પીડા હોય ત્યારે સારા વિચારો આવવા બહુ મુશ્કેલ છે. વેદના થોડા સમયની જ હોય પણ તેની તીવ્રતા આપણા લાગણીતંત્રને ખળખળાવી મૂકે. તેથી વિચારો પર કાબૂ ન રહે. આવા સમયે શું કરવું ? આપણને ગમતો એક વિચાર પકડી લઈ તેની પર સ્થિર થવું. ખાસ કરીને ભવિષ્યનો વિચાર કે આપણા આત્માના લાભનો વિચાર.

રણમેદાનમાં સૈનિક ઘાયલ થઈ પડ્યો હોય, શરીરમાં ત્રીસ ચાલીસ ગોળી વાગી હોય. શરીરમાં તીવ્ર પીડા હોય. આવા સમયે સૈનિકના મોઢા પર હાસ્ય ફરકી શકે છે. એ વિચારથી કે - ‘બલે હું મરી જઈશ પણ મારી માતૃભૂમિ મુક્ત બનશે.’ આ એક જ વિચાર ઘાયલ સૈનિકને સ્વસ્થતા આપે છે.

મને યાદ આવે છે મહારાજજી. જીવનમાં અનેકવાર તેમને જીવલેણ માંદગીનો ભોગ બનવું પડ્યું. દરેક વખતે તેમણે કોઈ એક શ્લોક લઈને તેના વિચારમાં મન પરોવી દીધું હોય. કાં તો જ્ઞાનસારનો શ્લોક હોય યા કોઈ બીજો. -

નિર્વાણપદમણ્યેકં ભાવ્યતે યનમુહુર્મુહુ: ।  
તદેવ જ્ઞાનમુત્કૃષ્ટં નિર્બન્ધો નાસ્તિ ભૂયસા ॥

‘બસ ! એક નિર્વાણ = મોક્ષની યાદ નિરંતર રહ્યા કરે તેટલું જ્ઞાન પૂરતું છે.’ આ એક વાક્ય તમને અશાતામાં રાહત આપતું. દુશ્મનો પર કરુણાના વિચાર તેમને માંદગીમાં આવતા. સારા વિચારો તેમના રોગની દવા હતી.

શરીર જ્યારે જ્યારે અસ્વસ્થ બને

મન જ્યારે જ્યારે ઢીલું થઈ જાય ત્યારે ત્યારે શાલિભકજીને યાદ કરજો. ધગધગતી શિલા ઉપર સૂતા સૂતા એ ક્યો વિચાર કરતા હશે ? એ જ કે - ‘તાપ શરીરને બાળે છે આત્માને નહીં, શરીરમાં તાપ થાય અને મન ઠંડું હોય તો કર્મની બળી જાય છે. આ તાપ મારા કર્મની નિર્જરામાં સહાયક છે.’

ગજસુકુમાલ મુનિવરને યાદ કરજો. માથાં ઉપર સળગતા અંગારા દાડાતાં હોય તે વખતે તે શું વિચારતા હશે ? એ જ કે - ‘અહીં તો કેવળ મારા માથાં પર અંગારા છે નરકમાં તો આખા શરીરે નહીં શરીરની ભીતર નસેનસમાં અંગારા બળતા હોય તેવો તાપ મેં સહન કર્યો છે. તેની સામે આ તાપ શું છે ?’ તેઓ ભગવાનના વચનમાં દૂબી ગયા.

ખંધકમુનિના શરીર પરથી ચામડી છોલવામાં આવતી હતી ત્યારે તેમને શું વિચાર આવતા હશે ? એ જ કે - ‘આ ઉપસર્ગ તો મને જડપથી મોક્ષમાં લઈ જવા માટે આવ્યો છે.’

એક સારા વિચારમાં એટલી તાકાત છે કે -

ખરાબમાં ખરાબ પરિસ્થિતિ, શરીરસ્થિતિ કે મનઃસ્થિતિમાં આત્મસમાધિને અકબંધ રાખે. તમને આત્મસમાધિ પ્રાપ્ત થાઓ.

॥ એં ॥

### ધર્મલાભ.

વેદના થતી હુશે. વેદના રોગને આધીન છે. રોગ શરીરને આધીન છે. શરીર કર્મને આધીન છે. કર્મ આપણે કરેલા ભૂતકાળનાં અશુભ ભાવોને આધીન છે. ભાવોને અશુદ્ધ બનાવવા કર્મ શરીરનું માધ્યમ લઈ વેદના ઊભી કરે છે. આવા સમયમાં અજાણ વ્યક્તિ રોગને અથવા તે શરીરને દોષ આપે છે.

પીડા તીવ્ર હોય ત્યારે શરીર ઉપર પણ દ્વેષ જાગે તે સહજ છે. જે દેખાય તેને દોષ દેવો એ મનનો સ્વભાવ છે. આ સ્વભાવ આર્તદ્યાનનું કારણ બની જાય છે. ‘મારા શરીરમાં રોગ છે. મને પીડા થાય છે.’ આ વિચાર અને લાગણી અસમાધિનું કારણ બની રહે છે. આપણે રોગની નહીં અસમાધિની દવા કરવાની છે. રોગ શરીરમાં છે, અસમાધિ મનમાં. અસમાધિથી બચતા રહેવાના ઉપાયને આપણે અપનાવવાના છે.

શ્રીસંખેગરંગશાળામાં આ માટે બહુ સરસ વાત કરી છે. શરીર નાની સરખી પીડા થાય ત્યારે આ વાત ઘૂંટતા રહીને મન સુધી પહુંચાડવા પ્રયાસ કરવો.

‘આ સંસારમાં દરેક જીવ પૂર્વે કરેલાં કર્મોનું જ ફળ ભોગવે છે. આપણું સારું થાય કે ખરાબ તેમાં બીજી બાબતો તો કેવળ નિમિત્ત છે.’

કેટલી સાચી વાત છે ? રોગ આપણને શરીરને કારણે થયો ? ના.... ! તો શરીર પર દ્વેષ શું કામ કરવો ?

પીડા આપણને રોગ આપે છે. ના... તો પીડા પર દ્વેષ શું કામ કરવો ? ‘મેં પૂર્વે બાંધેલા કર્મો જ ઉદ્યમાં આવ્યા છે. તે મારા મનને દુવિધામાં મૂકી હેરાન કરે છે. હું અસ્વર્થ થઈશ તો ભવિષ્યમાં પણ ખરાબ કર્મો જ બંધાશે. મારી ભૂતકાળની અસમાધિ મારા વર્તમાન રોગનું કારણ છે. તો મારી હમણાંની અસમાધિ મારા ભવિષ્યની પીડાનું કારણ બનશે..’

આપણે કેવળ રોગ દૂર કરીને આ ભવ સુધારવાનો નથી. આવનારા ભવોભવની સાધના કરી લેવાની છે. રોગ એ તૈયારીનો દૂત બની રહ્યો છે. તમારી સાધનાને ઉજાળવા આવ્યો છે.

॥ એ ॥

ધર્મલાભ

શાતા હશે.

આપણા જીવનમાં જે કંઈ પણ બને છે તેની પાછળ કોઈ કારણ હોય છે. દુઃખ આવે છે તે પણ પ્રયોજન લઈને જ.

દુઃખ આપણને વધુ મજબૂત બનાવવા આવે છે.

દર્દ આપણી સહૃદનશીલતાની પરીક્ષા લેવા આવે છે. એમ સમજો કે આપણને તૈયાર કરવા આવે છે.

આ જીવનની પેલે પાર જે જીવન છે તે સારું-સુંદર અને ધર્મમય બનાવવા જે માનસ જોઈએ તે બનાવવા દુઃખ જ મદદ કરે છે. એટલે તો દુઃખમાં જ ભગવાન વધારે યાદ આવે છે. દુઃખ તો આપણને જગાડે છે. આપણું મિત્ર છે.

સંકલેશ આપણને હેરાન કરે છે. મનમાંથી સંકલેશ ટળે તો સમાધિ સહૃજ બને છે. સમાધિ જીળવવામાં મદદ કરે છે - ભાવના અને ભાવના કેળવવામાં મદદ કરે છે - ભગવાનના શબ્દો, ભગવાનની વાતો.

ભગવાન કહે છે - જીવ અનાદિ છે. આપણે આત્મા છીએ. આત્માનો જન્મ નથી, મૃત્યુ નથી. આત્માને રોગ પણ નથી. જન્મ - જરા - મરણ - રોગ આ બધા શરીરના સ્વભાવ છે. શરીર છે તેથી ઊભા થાય છે. શરીર જતાં જતા રહે છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બધી ઉપાધિ છે. સંસારમાં છીએ ત્યારથી શરીર છે અને સંસારમાં છીએ ત્યાં સુધી શરીર રહેવાનું છે.

આપણે શરીરની ચિંતા કરીએ તો આત્માનું સુખ ભુલાઈ જાય અને આત્માની ચિંતા કરીએ તો શરીરનું દુઃખ ભૂલાઈ જાય. આપણને શરીર વળયું છે, આપણા કર્મોને કારણો. કર્મો આપણી જનમજનમની અધૂરી ઈરછાઓ પૂરી કરવા બંધાય છે. આ ઈરછાઓ શરીર વિના પૂરી થાય તેવી હોતી નથી, તેથી શરીર મળે છે. શરીરની સાથે જ

તકલીફો આવે છે. કર્મનું કારણ આપણી અધૂરી ઈચ્છાઓ છે.

આપણા રોગનું કારણ જંતુ નથી, આપણી ઈચ્છાઓ છે. ઈચ્છા જેવો કોઈ રોગ નથી. રોગ ઈચ્છાનું બાયપ્રોડક્ટ છે. ઈચ્છા છે ત્યાં સંકલેશ છે. સંકલેશ છે ત્યાં દુઃખ છે. સંસાર આખો ઈચ્છાની પેદાશ છે. માટે જ દુઃખરૂપ છે.

દુઃખ આપણને અતૃપુષ્ટ ઈચ્છા વિષે સભાન કરે છે. મારી કઈ ઈચ્છા અધૂરી છે ? મારી કઈ ઈચ્છામાં સુખ ભોગવી લેવાનો સ્વાર્થ છે ? આ વાત યાદ કરાવવા દુઃખ આવે છે.

સુખની ઈચ્છાથી મુક્ત થઈ જઈએ. સ્વાર્થ આપોઆપ જતો રહેશે. સ્વાર્થથી મુક્તિ મેળવી લઈએ તો સંકલેશ આપોઆપ મટી જશે.

આત્માનો વિચાર

આત્માની ચિંતા અને

આત્માનો ઉપચાર

શુભભાવનાથી થાય છે અને

ઈચ્છા મુક્તિ જેવી શુભભાવના બીજી એક નથી

‘કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,  
એક ઈચ્છા છે હવે તે પણ ન હો.’

શુભ ભાવના તમને સ્વસ્થ રાખે.

॥ ऐँ ॥

परमात्मा !

आम तो हुं तमने रोज याद करुं छुं. आज सुधी में तमने  
क्यारेय बोलाव्या नथी.

परंतु आजे एक प्रार्थना लहि आव्यो छुं.

ज्यारे हुं बोलावुं त्यारे मारा मनमां आवज्ञे.

हुं तमने दोलत माटे नहीं बोलावुं.

दृढ़मां राहत मने त्यारे नहीं बोलावुं.

मनमां ज्यारे आंतरशत्रुनी लडाई जामे,

मारी समाधि जोखममां मूकाती लागे,

त्यारे पणनी राह जोया विना आवी जज्ञे.

हुं तमने सुख माटे नहीं बोलावुं.

हुःख दूर करवा पाण नहीं बोलावुं.

मनमां ज्यारे सुखनी अपेक्षा जागी जाय,

हुःखमां अकणामणि थवा लागे,

मारी समता नंदवाती लागे त्यारे

विना विलंबे मने संभाणी लेज्ञे.

- तमारो कर्म रोगी भक्त

॥ એ ॥

શાતા હશે. શરીરમાં તાવ છે. અશક્તિ છે. છતાં તમારું મન પ્રસત્ત જ હશે.

જીવ જ્યારે સુખમાં હોય છે ત્યારે ભાન ભૂલી જાય છે. વગર વિચાર્યા કામ જોરશોરથી કરે છે. પાપના વિચાર, પાપી વાણી અને પાપાચરણમાં નિરંતર દૂબેલો રહે છે. વિરતિની વાતોની ધરાર અવગણના કરે છે. રંગરાગમાં દૂબી જઈને ભગવાનનું નામ ભૂલી જાય છે.

કર્મની થપાટ પેડે કે સાચી સમજ મળે ત્યારે પોતાની ભૂલ સમજે છે. ત્યારે તેને થાય છે કે ‘મેં શું કર્યું ? હું સુખ પાછળ પાગલ બન્યો એ મોટો ભૂલ થઈ. સુખને માટે મેં ખોટાં કામ કર્યા. મોહે મને ભાન ભૂલો બનાવ્યો. દુનિયાના વ્યવહાર સંબંધો બધું જ ખોટું છે. કેવળ ભગવાનનું નામ સાચું છે.’

ભગવાનનું નામ સુખના સમયમાં સાચી સમજાણ આપે છે. દુઃખના સમયમાં સમાધિ આપે છે. દેહની પીડા હોય તો શાતા આપે છે. ભગવાનનું નામ બધી જ ભ્રમણાઓને દૂર કરે છે. અણધારી આપત્તિ આવી જાય તો પણ આત્માને આરામ આપે છે.

આ યુગનું જીવન જ એવું છે કે કોઈને કોઈ ઉપાધિ આવ્યા જ કરે. આ બધી આધિ-વ્યાધિ અને ઉપાધિથી ધૂટકારો મળે એવું આપણે જંખીએ, પણ આપણે કર્મ જ એવાં કર્યા છે કે અશાંતિ ઓછી ન થાય. ભગવાનના નામે જીવનનો આ સંગ્રહ થોડો હળવો જરૂર બને છે.

આપણી વેદના - ઉપાધિ - અશાંતિને દૂર કરવા ઘણા ઘૂતારા દેવનો વેષ લઈને ફરે છે. બિચારા-દુઃખીયા લોકો મંત્ર-તંત્રનો જાપ કરે છે. પણ આ ચીજ સાચી નથી. ભગવાનનું નામ સાચાં હિલથી લઈએ તો તમામ પીડાઓનો અંત આવી જાય.

ભગવાનનું નામ શરીરના રોગની દવા નથી, કર્મરોગની દવા છે. નિરંતર ભગવાનના નામમાં દૂબેલાં રહ્યો. પીડાનો અહેસાસ ઓછો થશે.

૧૦-૧-૧૧  
(પ્રવિશુ દેસાઈ)

॥ એ ॥

પરમાત્મા !

જવનમાં દુઃખના પણ તૂટી પે  
તો કોઈ ચિંતા નથી  
શરીર રોગોથી ઘેરાઈ જય  
કોઈ ફિકર નથી.  
મનની પ્રસ્ત્રતા  
અને  
આત્માની સમાધિ  
જાળવી શકાય એટલું સત્ત્વ આપી દો.  
‘મળ્યા છે દર્દ કાયાને, મને વરદાન લાગે છે  
કરમને તોડવાનું એ રીતે, આસાન લાગે છે  
દરદનો શાંતભાવે હું, સદા ઉપકાર માનું છું  
હું તો આ આપદાઓને સદા ઉપહાર માનું છું.’

॥ એ ॥

પરમાત્મા !

દર્દ સહન કરવાની મારામાં કોઈ શક્તિ નથી..

તમારા વચ્ચનો ઉપરની શ્રદ્ધાથી

દર્દનો સ્વીકાર કરવાની સમજ આવી છે.

અત્યારે તો આ શ્રદ્ધા મજબૂત છે.

સમજ પાકી છે.

દર્દ વધી જાય ત્યારે પણ આ શ્રદ્ધા ટકી રહે એવું બળ દેજો.

જેમ જેમ વેદના વધે તેમ તેમ શ્રદ્ધા ખીલે.

શરીર ભલે મને પરેશાન કરે તમે મારા અંતરમાં છો. તેનો અપાર આનંદ છે.

જવાળામુખીની ટોચ પર બેઠો હોઉં

ત્યારે

મારી ભીતર ચંદનનો લેપ

કર્યા કરે તે મારો પરમાત્મા...

॥ ऐँ ॥

મનને સમાધિમાં મસ્ત રાખવા નીચે મુજબ પ્રાર્થના કરશો.

હે અરિહંત પ્રભુ ! હું સાવ પામર જીવ છું. મારામાં જરાપણ સત્ત્વ નથી. મને તકલીફ પે ત્યારે મન દુર્ભાવથી વેરાઈ જાય છે. મને સદ્ભાવમાં રહેતા શીખવ.

મારો રોગ મેં બાંધેલા કર્મ ખપાવવા જ આવ્યો છે એ સમજણ ટકાવી રાખ. શરીરમાં પીડા છે પણ એટલી જાલિમ નથી કે ચીસાચીસ કરું. એ તારો જ પ્રભાવ છે. તારી જેમ મારા મનમાં પણ દુનિયાના તમામ જીવોને સુખી કરવાના ભાવ છે.

હું તારા શરણે છું. જીવાડવો કે મારવો એ તારા હૃથમાં છે. ના ! તારી પાસે હું એ નહીં માગું કે મારી વેદના ઓછી કરી દે. એટલું જ માંગીશ - ગમે તેવી વેદના આવે તો પણ સહન કરવાની શક્તિ અખૂટ રહે. તારી કરુણાનો ઝરો ઝીલી શંકું એ માટે હું પૂરી રીતે તૈયાર છું.

પ્રભુ ! ભૂતકાળમાં મેં ઘણી ભૂલો કરી છે. તેનો મને પારાવાર પસ્તાવો છે. આ રોગ મારી ભૂલોની જ સજા છે. મને તે માટે કોઈ ફરિયાદ નથી. મારી ભૂલો અને મારા પાપો ઘોવાઈ જાય એ માટે મેં મારી જાત તને સોંપી દીધી છે. મને તારું શરણું મળ્યું છે. મારા જેવા આગધદ-આગસમજુ-અપરાધીને શરણ આપી દે. તારા ચરણોમાં મસ્તક જુકાવી શંકું તેટલી પાત્રતાનું દાન કરી દે.

પ્રભુ ! આ સમયમાં મને તારા સંગાથની ખૂબ જરૂર છે. તારા વિના આ વેદના સહન કરવી બહુ જ કઠણ છે. મારા મનમાં હરહંમેશા તું રહે. તારો હૃથ મારા મસ્તક પર છે એ વિશ્વાસે જ હું જીવું છું. મસ્તીથી જીવું છું. મારા મનમાં તારું સ્મરણ નિત્ય રહે એટલી જ પ્રાર્થના છે.

॥ એં ॥

### પ્રાર્થના

સિદ્ધ ભગવંતો ! આપ સુખના અફાટ સાગરમાં વિહરો છો. આપને શરીર નથી. તેથી આપને કોઈ રોગ નથી, વેદના નથી, પીડા નથી. તમારા આત્માના એક એક પ્રદેશ પર એટલું સુખ છે કે આખી દુનિયામાં ન સમાય. એ સુખની એક જલક મેળવી શકું એવી નિર્મણતા મને આપો.

સિદ્ધ ભગવંતો ! આપ સુખી છો, કેમ કે આપને કર્મ નથી. કર્મ છે તો ફળ છે. સુખ-દુઃખ છે. રુચિ-અરુચિ છે, રાગ-દ્રેષ્ટ છે, સંસાર છે. આપ કર્મમુક્ત છો કેમ કે - રાગદ્રેષ્ટથી મુક્ત છો. મને રાગદ્રેષ્ટથી મુક્ત થવાની કળા શીખવો.

ગજસુકુમાલ, સંકંદક સૂ.ના શિષ્યો, સુકોશલ મુનિ જેવા સિદ્ધો ! મરણ પહેલાં આપની ઉપર ઘણી વેદના આવી. ભ્યાનક ઉપસગ્નો થયા. કારમી પીડા થઈ. આ બધામાં આપે આપનું મન સ્વસ્થ કેવી રીતે રાખ્યું ? શું વિચાર કર્યા ? શું ભાવના કરી ? તે મને શીખવી દો.

સિદ્ધ ભગવંતો ! હું નસીબદાર છું. આપ હુંમેશા મારા માથે છો. આપ સદા માટે મને નીછાળો છો. આપ ચંદ્રના કિરણો કરતાં વધુ નિર્મળ છો.

આપ સૂર્યના કિરણો કરતાં વધુ તેજસ્વી છો.

આપ સાગર કરતાં વધુ ગંભીર છો.

આપના પ્રભાવે મને સિદ્ધ મળે.

આપના આલંબને મનમાં સમભાવ કેળવાય.

શરીરની આસક્તિ તૂટે, કર્મ છૂટે, સંસારથી મુક્તિ મળે...

હું હુંમેશા આપના શરણો છું.

॥ એ ॥

ધર્મલાભ,  
શાતા હંશો.

પ્રાર્થના : હે સાધુ ભગવંતો ! આપ સહનશીલતાની મૂર્તિ છો. ઠંડી-ગરમી, જેવી શરીરની તકલીફો, માન-અપમાન જેવી મનની તકલીફો, રાગ-દ્વિષ જેવી મોહજન્ય તકલીફો શ્રદ્ધા-અશ્રદ્ધા જેવી આત્માની તકલીફોને આપ સહન કરો છો. આપની પાસે શરીરનું બળ છે, મનનું સત્ત્વ છે, આત્માનું વીર્ય છે અને સમ્યકૃત્વ છે. તેથી આપ અપાર સમતા અને સમાધિમાં છો. હું આપના શરણો છું. મને આપના જેવી સહનશીલતા, સત્ત્વ અને સમ્યકૃત્વની શક્તિ આપો.

હે સાધુ ભગવંતો ! મુસીબતોની સામે અડગ ઊભા રહેવું આસાન નથી. મનને મજબૂત રાખવું સહેલું નથી. શરીરની પીડા મજબૂતમાં મજબૂત સમજના ડિલાને તોડી નાંખે છે. પીડાનો અનુભવ આર્તધ્યાન કરાવે છે. એવું લાગે કે હું એકલો પડી ગયો. એકલતાનો ભય જન્મે છે. ભયની લાગણી મનને ગેરમાર્ગ દોરે છે. કથાયને જન્મ આપે છે. ખાસ કરીને દ્વેષને જન્મ આપે છે. કોથ જન્મે છે. રોગનો દ્વેષ અલગ રીતે બહાર આવે છે. મન બહારવડું બની જાય છે. આ સ્થિતિમાં મગજને સમતોલ અને મનને આત્મામાં મસ્ત રાખવું કેવી રીતે શક્ય છે ? સાધુ ભગવંતો ! આપ મનને મસ્ત રાખો છો. કેમ કે આપ દરેક તકલીફના મૂળને જૂઓ છો. તકલીફ શરીરની હોય, મનની હોય કે આત્માની, તેનું મૂળ કારણ કર્મ છે. મેં કરેલાં કર્મ તો પોતાની ફરજ બજાવે છે. મેં પીડા માંગી એટલે આવો છે. હવે હું વધુ દુર્ધ્યાન કરીશ તો વધુ પીડા થશે. ભૂતકાળમાં મેં ભૂલ કરેલી ત્યારે મારી પાસે સમજ ન ઉતી. હું મારી જાત પર ગુસ્સો કરું તે પણ શું કામનું ? બધું જ જતું રહેશે તો ચાલશે. મહામહેનતે મેળવેલી સમજ જતી રહે તે નહીં ચાલે.

મુનિ ભગવંતો ! આપની પાસે આ જાગૃતિ છે. એટલી જાગૃતિ કાયમ માટે ટકી રહે એવા આશીર્વાદ આપો. શરીરની પીડા આર્તધ્યાનમાં ન ફેરવાઈ જાય એટલી સહનશીલતા આપી દો. હું આપના શરણો છું.

૧-૧૨-૧૧

॥ ऐ ॥

शाता हुरे.

प्रशमरति नामना शात्वमां कहुं छे.

‘जन्म मराशथी भरेलां आ संसारमां भगवानना वयन सिवाय कोई शराणु नथी.’

- अभिमानथी आंधणा बनेलां ईद्रभूतिने साची समज मणी, भगवानना वयनोथी.
- कोधथी उकणता चंडकौशिकना अंतरमां क्षमाना बीजनु वावेतर कर्यु, प्रभुना वयने.
- अनंत संसार वधारी बेठला गोशाणाने सहगतिना द्वारे लઈ गया, भगवानना वयने.
- कोधना अंधापाथी विवेक खोई बेठला चिलातीपुत्रने बचावी लीधा-भगवानना वयने.

कपायोथी दाझेला चित्तने टाढक आपवानुं काम करे छे - प्रभुना वयन. कोई सरस कहुं छे - ‘सुख छे भुँ ने दुःख छे रुँ, ऐवो आ संसार.

अंतरमां ज्यारे आग बणे ने घेरी वणे संताप,

त्यारे छाटे शीतल पाणी, ऐवी मारा वीरनी वाणी.’

धर्म एटले प्रभुना वयनो. हुं प्रभुवयनना शराणु छुं. ते ज मने प्रेमथी कल्याणाना मार्णे लઈ जाय छे. ते ज मने भीतरना संतापोथी बचावरो. आजे आ स्थितिमां हुं स्वस्थ छुं, ते धर्म-प्रभुवयनना प्रतापे.

ज्यारे ज्यारे वेदना के पीडा थाय त्यारे ए ज विचार करवो के - भगवाने मने शु कहुं छे ? श्री मेघकुमार मुनिने याद करवा. आधी रात परेशानी भोगवी, आर्तध्यान कर्यु, घरे जवाना विचार कर्या. भगवाने तेमने पूर्वभव याद कराव्यो. पशुना भवमां जे कष सहन कर्या छे तेनी सामे आ भवनुं कष तो कंठ ज नथी. पशुना भवमां भगवान न हता, समज न हती. आ भवमां समज तो छे. समज टकाववानुं श्रेष्ठ आलंबन भगवानना वयनो छे. हुं प्रभुवयनना शराणु छुं ? भगवान जे कहेशे ते करीश. मारो बेडो पार थई जशे.

२-२-२०११

॥ એં ॥

સમતાથી દર્દ સહું, પ્રભુ ! એવું બળ દેજો,  
મારી વિનંતિ માનીને, મને આટલું ફળ દેજો...

કોઈ ભવમાં બાંધેલા મારા કર્મો જાગ્યા છે,  
કાયાના દર્દ રૂપે, મને પીડવા લાગ્યા છે,  
આ શાન રહે તાજું, એવું સિંચન જળ દેજો....

દર્દોની આ પીડા, રોવાથી મટશે નહીં,  
કલ્યાંત કરું તો પણ, આ દુઃખ તો ઘટશે નહીં,  
દુધર્મન નથી કરવું, એવું નિશ્ચય બળ દેજો.

આ કાયા અટકી છે, નથી થાતાં તુજ દર્શન,  
ના જઈ શકું સુણવાને, ગુરુની વાણી પાવન,  
જિનમંદિર જાવાનું, ફરીને અંજળ દેજો.

નથી થાતી ધર્મકિયા, એનો રંજ ધારો મનમાં,  
દિલહું તો દોડો છે, પણ શક્તિ નથી તનમાં,  
મારી હોંસ પૂરી થાયે, એવો શુભ અવસર દેજો.

છોને આ દર્દ વધે, હું તો મોત નહીં માણું,  
વળી છેલા શાસ લગી, હું ધર્મ નહીં ત્યાગું,  
રહે ભાવ સમાધિનો, એવો અંતિમ પળ દેજો.

સમતાથી દર્દ સહું...

(પ્રવિષ્ટ દેસાઈ)

॥ એँ ॥

પુણ્યપ્રકાશના સ્તવનમાં મનને સમાધિભાવમાં રાખવાના દસ ઉપાય બતાવ્યા છે. મન શુદ્ધ હોય તો સહજભાવે સમાધિમાં રહે છે. મનમાં સંક્લેશ હોય તો સમાધિ રહેતી નથી. આ દસ ઉપાય મનને શુદ્ધ કરવામાં મદદ કરે છે.

પહેલો ઉપાય છે - અતિયારની આલોચના..

જીવનમાં ભૂલ થઈ જવી સહજ છે. કપડાં પર જેમ ગંદકીનો ડાઘ પે તેમ મનમાં દોષનો ડાઘ પે છે. કપડાંનો ડાઘ સાફ કરવાની મહેનત થાય છે તેવી મહેનત મનના દોષ સાફ કરવા કરવી તે આલોચના. પાપ થઈ જાય તે માફ થઈ શકે છે. પાપની શુદ્ધિ ન થાય તો કર્મ તેની માફી નથી આપતું. જે પાપ સાફ થતું નથી તે માફ પણ થતું નથી. મરીચિએ અભિમાન કર્યું તે ભૂલ, તેની આલોચના ન કરી તે મોટી ભૂલ.

આલોચના કરવાથી પાપની તાકાત ખૂબ ઘટી જાય છે. શ્રેણિક મહારાજાને કોણિકના કોરડા પડતા હશે ત્યારે કેવી કાળી વેદના થતી હશે ? આ વખતે તેઓ શું વિચારતા હશે ?

‘મેં ભૂતકાળમાં આ ભૂલ કરેલી તેની આ સજા થાય છે. હૃદિશીને અને તેના બચ્ચાને એક તીરથી મારી નાંખ્યા ત્યારે તેમને કેવી વેદના થઈ હશે ? તેમની વેદનાની સામે મારી પીડા કંઈ જ નથી. મેં જે પાપ કર્યા છે તેની સામે આ પીડા નહીં બરાબર જ છે. મને તો હજુ મોટી સજા થવી જોઈએ.’ તેઓ દીકરા કોણિકને કહેતા હશે - ‘બેટા ! જેટલી સજા કરવી હોય તેટલી કરી લે. સમજ જાગતી છે ત્યાં સુધી સજા થઈ જાય તો મારું ભવિષ્ય, મારો પરલોક બગડશે નહીં. તું જે શ્રેણિકને મારી રહ્યો છે તે આ જ સજાને લાયક છે. કોણિક ! તું જે કરી રહ્યો છે તેનાથી મને જે વેદના થાય છે તેનું કારણ તું નથી, મારા કર્મો છે. આ વેદના હસતા હસતા સ્વીકારીને સહન કરું છું તો મારા દોષો શુદ્ધ થાય છે. મને વેદના થાય છે, મોઢમાંથી ચીસ નીકળી જાય છે, આંખમાંથી આંસુ વહી જાય છે તે દુઃખ કરતા મારું મન શુદ્ધ થાય છે, મારાં પાપ ખપે છે, મારો આત્મા શુદ્ધ થાય છે તેનો આનંદ વધુ છે. પાપોની આલોચના કરવાની આવી ઉત્તમ તક ક્યાં મળે ?’

॥ એँ ॥

શાતા હશે. મનને સમાધિમાં રાખવાનો બીજો ઉપાય છે - વ્રતનો સ્વીકાર.

બંગલાની સુરક્ષા માટે દિવાલ જરૂરી છે

બગીચાની સુરક્ષા માટે વાડ જરૂરી છે તેમ

મનની સુરક્ષા માટે વ્રત જરૂરી છે.

શરીરને સ્વસ્થ અને મનને આત્મસ્થ બનાવી રાખવું હોય તો મન ઉપર નિયંત્રણ આવશ્યક છે. ભૂતકાળમાં આપણે મનને છૂટો દોર આયો છે તેથી જ હાલમાં આપણે કુંઝી થઈ રહ્યા છીએ. વ્રતનો અર્થ છે - સુખી થવા માટે જરૂરી નિયંત્રણ.

વિજણીને વાયરનું નિયંત્રણ જરૂરી છે

ગાડીને બ્રેકનું જરૂરી નિયંત્રણ છે તેમ

મનને વ્રતનું નિયંત્રણ જરૂરી છે.

વ્રતથી બિનજરૂરી ઈચ્છાઓ ઉપર રોક લાગે છે, તેથી બિનજરૂરી અપેક્ષા અને સંકલેશ ઘટી જાય છે. મન પરનો ભાર હુટતાં તે સહજપણે પ્રસત્ત બની રહે છે.

વ્રત સ્વીકારવા બે વાતો પર ધ્યાન આપવું.

એક, જે બિનજરૂરી છે તેના બંધનમાંથી તફન મુક્ત થઈ જવું. દા.ત. દીકરાના દીકરાના દીકરાને આપણે રમાડવાના નથી તો તેની ઈચ્છાથી મુક્ત થઈ જવું.

બીજું, જે જરૂરી છે તેની ઉપરનો રાગ ઘટાડતા જવું. જરૂરીયાતોને સીમિત કરી દેવી.

ભાર વ્રત, ચૌદ નિયમ અને સંવરનો આ જ પરમાર્થ છે.

જીવનના એક એક ક્ષેત્રમાં મર્યાદા આવતી જશે તેમ મન હળવું ફૂલ બનશે.

રોજ એ વિચાર કરવો કે - ‘પાત્ર-પદાર્થ અને પરિસ્થિતિની આસક્તિ છૂટે. એક દિવસ એવો આવે કે આ સંસાર છૂટે. અરે ! આ શરીર પણ છૂટે. પછી રોગ-તેની પીડા આ તમામથી કાયમ માટે મુક્તિ મળી જાય.

‘ક્યારે બનીશ હું સાચો સંત, ક્યારે થશે મારા ભવનો અંત’

આ ભાવનામાં લયલીન રહો એ જ કામના.

૮-૧-૧૧

॥ એ ॥

શાતા દુશે.

મનની પ્રસંગતાનો ત્રીજો આધાર છે - ક્ષમાપના.

જન્મયા ત્યારથી અત્યાર સુધી આપણે સહુને તકલીફ આપી છે. આપણે ઈચ્છતા ન હોઈએ તે છતાં આપણા થકી બીજાને તકલીફ પહોંચે છે. સંસારનો એક જીવ એવો નથી જેને આપણે તકલીફ ન આપી હોય. આપણે બીજાને જાણી જોઈને તકલીફ આપીએ છીએ ત્યારે આપણે આપણી જાતને તકલીફ પહોંચાડવાની તૈયારી કરીએ છીએ. આપણો રોગ આપણે બીજાને આપેલી તકલીફનું પરિણામ છે.

આપણે એ જાણતા નથી કે - મેં ક્યારે, કોને, કેવી રીતે, શું તકલીફ આપી હતી કે શું કામ આપી હતી. પણ આપણને તકલીફ થાય છે તેનો ભતલબ આપણા દ્વારા કોઈ જીવ કુંખી થયો છે, આપણા મનમાં કોઈ જીવ પ્રાયે દુર્ભાવ છે. તેનું નામ-ઠામ આપણને ખબર નથી. પણ તે જે કોઈ છે, જ્યાં છે, જેવો છે તે મને માફ કરી દે. મને અત્યારે જે પ્રકારની પીડા થઈ રહી છે તે પ્રકારની પીડા મેં તેને પહેલાં આપી છે. એટલું જ નહીં, પીડા આપ્યાનો રાજ્યો અનુભવ્યો છે. મેં અણસમજમાં આ કામ કર્યું તે કર્મ દ્વારા મને પીડી રહ્યું છે. આજે મારી પાસે સમજ છે. તો તે જીવની હું ક્ષમા માગ્યું છું. મારી ક્ષમાના ભાવ એ જીવ સુધી પહોંચ્યો. તે હુંમેશા ખુશ અને સ્વસ્થ રહે. મારો રોગ જાય કે ન જાય પણ દુર્ભાવ તો જતો જ રહેવો જોઈએ.

તે જીવના મનમાં પણ ક્ષમાના ભાવ પ્રગટે અને તે મને માફ કરી દે. જે ક્ષાળે તે મને માફ કરશે તે ક્ષાળે મારો આત્મા પરમ શાંતિ, પ્રસંગતા અને હળવાશનો અનુભવ કરશે. હું તેની ભૂલોને માફ કરું છું, તે મારી ભૂલોને માફ કરે.

ખામોમિ સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મે ॥

આ સંસારમાં દરેક જીવો કર્મવશ છે. તેમનાથી ભૂલો થઈ જાય છે.  
મેં તેમને ખમાવ્યા છે. તે મને માફ કરે.  
સંસારના બધા જ જીવોને મેં સિદ્ધભગવંતોની સાક્ષીએ ખમાવ્યા છે.  
મારા મનમાં કોઈ પ્રત્યે વેર નથી,  
મારા મનમાં કોઈ પ્રત્યે દ્રેષ નથી.  
મારા મનમાં કોઈ પ્રત્યે દુર્ભાવ નથી.  
મારા મનમાં કોઈ પ્રત્યે ફરિયાદ નથી.  
આ ભવમાં પણ રાગદ્રોષથી મેં મારા સ્વજનો પર દુર્ભાવ કર્યો હોય તો તેની  
માફી માળી લઉં છું.  
ક્ષમાપનાના આ ઉત્તમ ભાવ મનને સરળ-સહજ-શાંત બનાવે છે...  
તમે તેનો અનુભવ કરો એ જ મંગલકામના.

॥ એઁ ॥

ધર્મલાભ.... સારું હશે.

સમાધિમાં રહેવાનો ચોથો ઉપાય છે - અઠાર પાપોનો ત્યાગ.

પાપ એટલે ભૂતકાળમાં થયેલી ભૂલનું વર્તમાન પરિણામ.

પાપ બાવળનાં કાંટા જેવું છે. ભૂલ બાવળનાં બી જેવી છે. બાવળ વાવો તો કાંટા ઉગવાના જ. રસ્તા પર કાંટાની ઉપસ્થિતિ જો નુકસાનકારક છે તો મનમાં પાપની ઉપસ્થિતિ નુકસાનકારક છે.

પાપ થઈ ગયા પછી પણ તે મનમાં સંસ્કારરૂપે જીવિત રહે છે. પ્રત્યક્ષ પાપ તો ફળ આપીજે જતું રહે છે પણ સંસ્કારરૂપ પાપ નવાં પાપને જન્મ આપે છે. પાપ કિયા કરતાં પાપના સંસ્કાર આ રીતે વધારે ખરાબ છે. રાવણા જીવનમાં પહેલાં પાપ ન હતું પણ સીતાના આર્કષણના સંસ્કારે તેની પાસે બળજબરી પાપ કરાયું.

પાપના સંસ્કારને ધોવાના બે સર્વોત્તમ ઉપાય છે. એક, પસ્તાવો. થયેલા પાપોને વિશુદ્ધ ભાવે યાદ કરી તેના સંસ્કારોને દૂર કરવા. પસ્તાવાના ભાવ પેઢા કરવા ખૂબ જ પવિત્ર મન જોઈએ, ખૂબ શક્તિ જોઈએ. આ ભાવ પેઢા કરવાની શક્તિ ભગવાનનું સ્મરણ આપે છે.

બીજો ઉપાય આ છે - પ્રભુ નામનું સ્મરણ. મન સતત ભગવાનમાં રહે તો પાપના સંસ્કાર આપમેળે ધોવાતા રહે છે. દુઃખ કે પીડાના સમયમાં મનને સ્વસ્થ રાખવા પ્રભુનું નામ શ્રેષ્ઠ આલંબન છે.

॥ એ ॥

ધર્મલાભ.

શાતા હશે.

આપણને મળેલું જીવન ખૂબ જ સુંદર છે. તે એટલા માટે કે આ જીવન દ્વારા ઘણાં સારાં કામ થઈ શકે છે. સારાં કામ થઈ શકે તેવી સમજ આપણા જીવનની ખાસિયત છે. દુનિયામાં જેને જેને સારી સમજ મળી છે તે ધન્યવાદને પાત્ર છે. જે પોતાની સમજનો સદૃષ્યોગ કરી સારાં કામો કરે છે તે ધન્યવાદને પાત્ર છે. કોઈના સારાં કામ જોઈ શકીએ તેવી દસ્તિ અને તેની અનુમોદના કરી શકીએ તેટલું વિશાળ દિલ મળી જાય તો જીવન સફળ.

પ્રસતતાનું પાંચમું પગથિયું ‘સુકૃતની અનુમોદના’ છે.

આપણાં જીવનમાં આપણે જે જે સારાં કામ કર્યા છે તેની દિલથી અનુમોદના કરવી.

મેં આજીવનમાં મારા માતાપિતા, ગુરુજન, સ્વજન, પરિવારનું સારું જ ઈચ્છયું છે. સહુને પ્રેમ અને વાતસાલ્ય આપ્યાં છે. મને સારાં સ્વજનનો મળ્યાં તેની અનુમોદના. તેમણે કરેલાં સારા કામની અનુમોદના અને મેં તેમને માટે કરેલા સારા કાર્યની અનુમોદના.

આપણા જીવનમાં આપણને શું શું સારું મળ્યું છે તેની અનુમોદના કરવી.

બીજાના જીવનમાં આપણે જે જે સારું જોયું તેની અનુમોદના કરવી.

આપણા જીવનમાં આપણે શું શું સારું કર્યું તેની અનુમોદના કરવી.

સારા સંયોગ અને તક મળે તો હું શું શું સારું કરી શકું તેની કલ્પના કરી તેની અનુમોદના કરવી.

આ બધી બાબતોનું એક લીસ્ટ બનાવી તેની અનુમોદના કરવાથી મનને સાત્ત્વિક બળ મળશે.

અનુમોદના પાણી જેવી છે.

આપણા મનમાં રોપાયેલા શુભભાવોના છોડને ખીલવવા અમૃતતનું કામ કરે છે.

॥ એ ॥

શાતા હશે.

મનની પ્રસંગતાનો સાચો આધાર શું છે ? આપણે જાણીએ છીએ આપણા મનને. કલેશ-કર્મ-કષાયથી એટલું ભરેલું છે કે સમાધિની સુગંધ પણ પામી શકે નહીં. જલિમ રોગ અને પારાવાર પીડા વચ્ચે સમાધિમાં રહેવાની આપણી તાકાત છે ? ના. સમાધિની શક્તિ શ્રી અરિહંત પરમાત્મા આપે છે. શ્રી સિદ્ધ ભગવંતો આપે છે. તારક ગુરુભગવંતો આપે છે. સાચો ધર્મ આપે છે.

સમાધિ જ પ્રસંગતાનું પ્રવેશદ્વાર છે અને સમાધિ શરણે જવાથી મળે છે.

પ્રસંગતાનું છદ્દું પગથિયું ‘ચારશરણનો સ્વીકાર’ છે.

શરણ સ્વીકારવું એટલે આપણી તમામ જવાબદારી સોંપી દેવી.

આપણી પોતાની, આપણા શરીરની, આપણા આત્માની પણ.

મને રોગી રાખવો કે નિરોગી તે જવાબદારી અરિહંતાદિ ચારની.

મારા મનને સ્વસ્થ રાખવું કે અસ્વસ્થ એ નક્કી કરવાનું અરિહંતાદિએ.

રોગ આવે છે, પીડા થાય છે ત્યારે તેની વેદના આપણે જ સહન કરવાની હોય છે. ડૉક્ટર શરીરને શાતા આપી શકે, સ્વજનો સહાનુભૂતિ આપી શકે, પણ સમાધિ તો અરિહંત વિ. જ આપી શકે. પરિપૂર્ણ સમર્પણ વિના સમાધિ મળતી નથી. સમર્પણમાં ખામી હોય તો સમાધિ ટકતી નથી.

મન વિરોધી સ્થિતિને સહન કરવા તૈયાર હોતું નથી. વિરોધી સ્થિતિને સહેલાઈથી સહન કરવા આલંબન જોઈએ. મનને અરિહંતાદિ ચારનું શરણ આપી દેવાથી તે દબાણમાં આવતું નથી.

જ્યારે જ્યારે ટ્રીટમેન્ટ લેવા જવાનું થાય ત્યારે ત્યારે ચાર શરણનો સ્વીકાર કરી લેવો. મનની ચિંતા તેમને સોંપી દેવી. તેમના પ્રભાવે બધું જ સાંદું થઈ જશે, તેવી ભાવના કરવી. આપણો રોગ આપણી શક્તિથી નહીં, આ ચારની શક્તિથી જ દૂર થશે.

૨૫-૧-૧૧

॥ એ ॥

ધર્મલાભ...

શરીર સાફ ન હોય તો શાશગાર વ્યર્થ જાય છે.

પેટ સાફ ન હોય તો ઉપચાર વ્યર્થ જાય છે.

વખ સાફ ન હોય તો અત્તર વ્યર્થ જાય છે.

તેમ અંતર સાફ ન હોય તો આરાધના વ્યર્થ જાય છે.

મન સાફ કર્યા વિના પ્રસંગતા પ્રામ કરવી દુર્લભ છે.

પ્રસંગતાનું સાતમું સોપાન ‘દુષ્કૃતની નિંદા’ છે.

આપણા જીવનમાં આપણે જે દુષ્કૃત કર્યા છે તેના ભારથી મુક્ત થઈ જવું. આપણે ઘણી ભૂલો કરી છે. આપણે ભૂલોનો ભૂલ તરીકે સ્વીકાર કરતાં નથી. ઘાની સારવાર ન કરીએ તો સરી જાય તેમ ભૂલનો સ્વીકાર ન કરીએ તો દુષ્કૃત બની જાય. વકરેલો વા વધુ પીડા કરે તેમ દુષ્કૃત બની ગયેલી ભૂલ વધુ પીડા કરે.

આ જીવનમાં મેં સારા કામ ઘણા ઔછાં કર્યા છે. ન કરવા જેવા કામ ઘણાં કર્યા છે.

ખાસ તો મારા દ્વારા જાણે અજાણે ઘણાં જીવને સંતાપ થયો છે. અથવા એક જીવને ઘણું સંતાપ થયો છે. આ દુષ્કૃત જ મને પીડી રહ્યું છે.

મેં કોઈની સાધનામાં અંતરાય ઊભો કર્યો છે તેથી મને અંતરાય થઈ રહ્યો છે.

મેં કોઈને અશાની આપી છે તે મને હેરાન કરી રહી છે.

મારા દ્વારા જે જે જીવને સંતાપ થયો છે તે બધા જીવોને શાતા મળે, પ્રસંગતા મળે તેવી ભાવના ભાવું છું.

મારો રોગ દૂર થાય એ પછીની વાત છે. પહેલી વાત મારી સમાધિ નિશ્ચલ રહે.

મારું હઠય એટલું ઉદાર બને કે હું મારા દુશ્મનને માફ કરી શકું.

મારું દિલ એટલું સરળ બને કે મને પરેશાન કરનાર વ્યક્તિને પણ શાતા આપી શકું.

મારું મન એટલું સ્વસ્થ બને કે ગમે તે સ્થિતિને સ્વીકારી શકે.

મારું શરીર એટલું સહનશીલ બને કે રોગનાં ગમે તેવા આકમણને જીલી શકે.

મારી બુદ્ધિ એટલી સ્વર્ચ બને કે ગમે તે સંયોગોમાં સાચી સમજને ટકાવી રાખે.

॥ ऐँ ॥

धर्मलाभ,

मनने प्रसन्न राखवानुं आठमुं पगथियुं छे - 'शुभभाव'

मन जेटले अंशो पोळिटिव भावथी भरेलुं हुशे तेटले अंशो प्रसन्न रहेशो.

आपणा ज्ञवननां जे दिवसे जे क्षाणे प्रसन्नता मणी हुती तेने याद करवी.

जे दिवसे उतम भावे शत्रुंजयनी यात्रा करी. भगवाननी पूजा करवामां आनंद अनुभव्यो तेने याद करवी.

मने आ ज्ञवन मण्युं, आ देह मण्यो, समज मणी, सारो परिवार मण्यो तो  
मने केवा उतम लाभ थया, भगवान मण्या, सारा सद्गुरुनो योग मण्यो.  
सुबोधधाई पासे धर्मनी साची समज मणी. तेनाथी प्रेरणा मेणवी अनेक काम कर्या.  
गुरुदेवनो संयोग थयो. गुरुदेवनी भक्तिमां ज्ञवननी केटलीक क्षाणो खर्यी. अवारनवार  
तेमनां पात्रमां मारा हाथे आहुरादान कर्या. ज्ञाननी भक्ति करी. पूजा करवानो लाभ  
मण्यो. व्याख्यान श्रवण कर्या. प्रतिकमाण कर्या. अनुकंपा दान कर्या. आ सारी समजने  
काराणे बन्युं.

मारा हाथे जे कंઈ सुकृत थयुं ते खूब सारु थयुं. मारी शक्ति, मारी समज,  
मारी संपत्ति सारा स्थानमां वपराया. हुज पाण वपराता ज रहो.

जो मारी शक्ति मने साथ आपे तो हुं राजा संगतिनी जेम धरतीने प्रतिमाथी  
भरी दउ. चारे बाजु प्रभुना धर्मनी प्रभावना करुं. राजा कुमारपाण - वस्तुपाल -  
तेजपालनी जेम शास्त्रो लभावुं. संघ काढुं. पुणिया श्रावकनी जेम साधर्मिकोनी भक्ति  
करुं. ज्ञवद्याना काम करुं. गरीबोने मदद करुं. भूप्याने अश, तरस्याने पाणी,  
बेघरने धर, वखविहोणाने वख आपुं.

सारा कार्यो करवाना उतम भाव तमारा मनमां सतत रमता रहो.

॥ એં ॥

ધર્મલાભ,

પ્રભુ કહે છે - આ દુનિયાનો દરેક ડર મૃત્યુના ડરથી જ જન્મે છે. એકલતાનો ભય, અપમાનિત થવાનો ભય, તે રોગનો ભય; મૃત્યુના ભયથી જન્મે છે. જે મૃત્યુના ભયથી પર થઈ જાય છે તેને દુનિયાનો કોઈ ડર સત્તાવતો નથી.

જગલોમાં આટલા ઘોર ઉપસગ્રો વચ્ચે અગા રહેતા પરમાત્મા કે મુનિઓની નિર્ભય મનોદશાનું મૂળ આ છે. મૃત્યુનો ભય નીકળી ગયો પછી કોઈ જ ફિકર રહેતી નથી. જીવનમાં દુઃખ, દુઃખ લાગે છે, પીડા થાય છે કેમકે દરેક દુઃખ સાથે, દરેક પીડા સાથે આ ભય જાગૃત થાય છે. મૃત્યુનો સ્વીકાર કરી લઈએ તો કોઈ ભય, કોઈ પીડા આપણને સત્તાવી શકતા નથી.

મૃત્યુથી મોટો કોઈ ભય નથી. આ ભય જો જીતાઈ ગયો તો બધા ભય જિતાઈ ગયા. અંગેજમાં કહેવત છે - મૃત્યુ માણસને એક વાર જ મારે છે, મૃત્યુનો ડર રોજ મારે છે.

મૃત્યુના ડરનું કારણ છે - પરલોકનું અજ્ઞાન. મર્યા પછી મારું શું થશે ? અનું અજ્ઞાન મૃત્યુને ખોફનાક બનાવે છે. મર્યા પછીના જીવનની તૈયારી કરી લીધી હોય, સારી ગતિમાં જવાનો વિશ્વાસ કેળવી લીધો હોય, દેવ-ગુરુ ધર્મની દઢ શ્રદ્ધાનો સહારો લીધો હોય તો મૃત્યુનો ડર શેનો લાગે ?

મનની પ્રસત્તાનું નવમું સૂત્ર છે - 'સંલેખના' એટલે મૃત્યુનો સ્વીકાર.

જીવનમાંથી મોતાનો ભય નીકળી જાય તો આનંદ જ આનંદ બાકી રહે.

મહારાજજી કહેતા - 'જીવનું એટલે સારી રીતે મરવાની તૈયારી કરવી.' આ અર્થમાં જીવવાનો અપૂર્વ અવસર તમને મળ્યો છે. તેને પ્રસત્તામાં ફેરવશો.

॥ એઁ ॥

ધર્મલાભ, શાતા હશે.

શરીર સાધનાનું બાધ સાધન છે. મન સાધનાનું અંતરંગ સાધન છે. શરીરની શાતા-અશાતા મનની સમાધિ પર અસર કરી શકે છે. મન નબળું હોય તો સમાધિની આશા રાખવી પણ વ્યર્થ છે. મન નબળું હોય અને શરીરમાં પીડાનો તીવ્ર હુમલો આવે ત્યારે સમાધિ ટકાવી રાખવી મુશ્કેલ કામ છે. કેમ કે પીડા મનની વિચારશૃંખલાને છિન્નભિન્ન કરી નાંખે છે. આવા સમયમાં મન પીડા સહન કરવાની પ્રતિક્રિયામાં રોકાયેલું હોય છે. તેથી સારા વિચારો સહજતાથી આવતા નથી. આવા સમયમાં - જ્યારે સમજપૂર્વકની જગૃતિ ટકાવવી મુશ્કેલ હોય - તે સમયે મનને એક મજબૂત આલંબન આપી દીધું હોય તો તેના સહારે મન ફરી પાછું સ્વસ્થતા ધારણા કરી લે છે.

શ્રી નવકારમંત્ર આવું શ્રેષ્ઠ આલંબન છે. નવકારમાં વિશ્વની શ્રેષ્ઠ વ્યક્તિ અને શક્તિનો સમન્વય છે. વિશ્વમાં પ્રસસ્તાતાનો પમરાટ પ્રસરાવતી તમામ શુભશક્તિનો સંગમ નવકારમાં છે. નવકારમંત્રના સૂત્રની અને અર્થની અજબ તાકાત છે. કંઈ જ આવડતું ન હોય તો પણ એકલો નવકાર ગાણીને સદ્ગતિ પામી શકાય છે. અરે ! માત્ર નવકાર સાંભળીને વાનર જેવા તિર્યંચો દેવ પદ પામી ગયાના દાખલા છે.

નવકારમાં પાંચમું પદ ‘સાધુ’ છે. સહનશીલતા, સમતા અને સ્વીકારનું એ પ્રતીક છે. આ પદની સાધનામાં લીન રહેવાથી સહનશીલતા આપોઆપ ગ્રંગે છે. જ્યારે વેદના ઓછી હોય ત્યારે આ પદની ભાવના કરવી. આ જગતમાં જેટલા સાધુભગવંતો છે તે બધા કેટલા કષ સહન કરે છે અને તે પણ હસતે મોઢે. કોઈ આવીને મારી જાય કે અપમાન કરે; શરીરમાં રોગ હોય કે પીડા, તાપ હોય કે ઢંડી, બધું જ સહન કરતા રહે છે. તેમની સાધનાની શક્તિનો એક અંશ મારા મનમાં આવે. જ્યારે જ્યારે નમો લોએ સંબસાહૂં પદ બોલું ત્યારે ત્યારે મને સહનશીલ મહાપુરુષોનું સ્મરણ થાય. તેમની સહનશીલતા મારામાં અવતરે. તકલીફના સમયમાં મારા મનની સ્વસ્થતા ટકી રહે તેવું બળ આ સંયમી પુરુષો પાસેથી ગ્રામ થાવ.

- ધગધગતી શિલાને ફૂલની સેજ સમજ સ્વીકારનારા ધન્ના-શાલિબદ્ર ! આપ મને

આપના જેવી સહનશીલતા આપો. નમો લોએ સવ્વસાહૂણ.

- ઘાણીમાં ભગઝળીની જેમ પીલાતા સ્કર્ડકસૂ.મ.ના પાંચસો શિખ્યો ! આપના જેવો સમર્પણભાવ મને મળો. નમો લોએ સવ્વસાહૂણ.
  - માથા પર સણગતાં અંગારા બળી રહ્યા છે છતાં જેના મનમાં, મગજમાં, હદ્યમાં અપૂર્વ ઠડક પ્રસરાવતો સમતાભાવ છે તે ગજસુકુમાલ મુનિ ! આપના જેવા ક્ષમાભાવ મારા મનમાં ખીલવો. નમો લોએ સવ્વસાહૂણ.
  - વાધણ શરીર ફાડી નાંખવા આવી છે. નજર સામે શરીરના અવયવોને ફાડીને ચાવી રહી છે તેમ છતાં સુકોશલ મુનિના દિલમાં વાધણ પ્રત્યે મૈત્રીભાવ જ છે. ‘આ વાધણ મારા કર્મનો નાશ કરવામાં મદદ કરી રહી છે. તેથી મારી મિત્ર જ છે, મારી ઉપકારી છે, તેનું સદા કલ્યાણ થાવ’ સુકોશલ મુનિ ! આપના જેવું મૈત્રી ભાવનું પવિત્ર જરણું મારા હદ્યમાં પણ વહે. નમો લોએ સવ્વસાહૂણ.
  - શરીરમાં અસાધ્ય રોગ છે છતાં તેનો કોઈ ઉપચાર કરાવતા ન હોય તેવા મહુાત્મા આજે પણ છે તેમની આ નિસ્પૃહતાને લાખ લાખ પ્રશામ. નમો લોએ સવ્વસાહૂણ.
  - માથાં પર ગુમ્ફું થયું છે. પરુ નીકળે છે. કિડા પડ્યા છે. કિડા માથા પરથી ખરે છે તો ફરી માથામાં મૂકી દેતા મહુાત્માનો ઉત્કૃષ્ટ કોટિનો જીવદ્યાનો ભાવ મારા અંતરમાં પણ જન્મે. નમો લોએ સવ્વસાહૂણ.
- અઢી દીપમાં વિચરતા આવા સહનશીલ મહુાત્માઓની કૃપાનું બળ મને મળે. નમો લોએ સવ્વસાહૂણ પદ મારી જીબે રમે ત્યારે તેમની સાધનાના આશીર્વાદ મારા પર ઉત્તરે. આ ભાવના સાથે શ્રી નવકારમંત્ર અને પાંચમાં પદનો જાપ કરજો. પ્રસરતા દાસી બનીને તમારા પગમાં પડશે.

ફા. સુ. ૩

॥ એઁ ॥

ધર્મલાભ...

શાતા હશે.

શરીરમાં પીડા છે. વેદના થાય છે. તેનું કારણ કર્મ છે અને કર્મનું કારણ આપણા દોષ છે.

કર્મનો નિયમ કહે છે - જે દોષની આલોચના થતી નથી, નિંદા થતી નથી, ગ્રાયશ્વિત થતું નથી, પ્રતિકમણ થતું નથી તે દોષ પીડા આપે છે. દોષ જ્યારે ફળ આપે ત્યારે આર્તધ્યાન જન્માવે છે. આર્તધ્યાન નવા દોષને જન્મ આપે. આમ, આ ચક્કર ચાલ્યા જ કરે છે. આપણો આ ચક્કર તોડવાનું છે.

જ્યારે જ્યારે વેદના થાય, પીડા થાય, ત્યારે તેની ઉપરથી ધ્યાન ઉઠાવી કર્મ ઉપર કેંદ્રિત થવાનું. કર્મ ઉપરથી દોષ ઉપર કેંદ્રિત થવાનું.

આ પીડા મારા કર્મને કારણે આવી છે. આ પીડા મારા દોષના કારણે આવી છે. જેલમાં કૂણિકે મારેલી ચાબૂકના ફટકા ખાતા શ્રેણિક મહારાજ આ જ વિચારતા.

જે દોષ આપણો સેવ્યા છે. આ જનમમાં કે પરજનમમાં જે અપરાધ કર્યા છે તે સહુને સાઝ કરવાનો આ સમય છે.

ભગવાનને માથે રાખી,

સદ્ગુરુને સાથે રાખી,

સમજને હાથે રાખી

સતત દોષોનો વિચાર કરશો

તો પીડા જરૂર હળવી થશે.

॥ એ ॥

ધર્મલાભ,

શાતા હશે.

જીવન આપણો અનેક રીતે પરીક્ષા લે છે. તે તપાસવા માંગે છે કે આપણે શ્રેષ્ઠતા માટે પાત્ર છીએ કે નહીં.

નબળાં માણસો જીવનમાં આવતા સંઘર્ષની સામે હથિયાર મૂકી દે છે. અભિમાની માણસો સંઘર્ષની સામે લડાઈ કરે છે.

સમજુ માણસો સંઘર્ષને સ્વીકારી લે છે, સહજતાથી. ‘દુઃખનાં સ્વીકારમાં સુખ છે, ઈન્કારમાં દુઃખ છે.’ આ ભગવાનનું ગણિત છે. આ ગણિતને અમલમાં મૂકવાનો અવસર આવિ કે આપત્તિ છે. દુઃખનો સ્વીકાર કરી લેવાથી દુઃખ જતું નથી રહેતું પણ તેનો ભાર જરૂર હુણવો થઈ જાય છે.

દુઃખના ભારથી મુક્ત બનીને દુઃખ ઉપર વિચાર કરીશું તો દુઃખનું સાચું કારણ શું છે તે સમજશે. દુઃખનું કારણ રોગ નથી, શરીર નથી; કર્મ છે. અને કર્મનું કારણ આપણી ખોટી ભાવનાઓ છે. ખોટી ભાવના દૂર તો રોગ પણ દૂર.

ખોટી ભાવનાથી મુક્ત થવાનો એક જ ઉપાય છે. સાચી અને સારી ભાવના કરવી. મારે બધાને સુખી જોવા છે આ ભાવના વિશની શ્રેષ્ઠતમ ભાવનાઓમાં એક છે. પરમાત્માનાં નામ સાથે આ ભાવના જોડાયેલી છે માટે જ પરમાત્માનું નામ સમાધિદાયક છે.

૧૪-૩-૧૧

॥ એઁ ॥

ધર્મલાભ,

આજે આત્મશિક્ષા નામના શાસ્ત્રમાં એક બહુ સુંદર શલોક વાંચ્યો.

જેમના મનમાં સતત સારા કર્મ બંધાય તેવા વિચાર ચાલતા હોય તેમને ત્રણ મોટા ફાયદા થાય છે.

એક, તેમનું પુણ્યબળ વધે છે.

બે, તેમનો મોક્ષ નજીક થાય છે, અશુભ કર્મો ઓછા થાય છે અને

ત્રણ, તેમના કલેશ દૂર થાય છે.

હજારો વરસના ઘેરા અંધકારની તાકાત કરતા દીવાસળીની ટોચ પર પ્રગટેલી જ્યોતાની તાકાત વધારે છે તેમ ખરાબમાં ખરાબ હજાર વિચાર કરતાં એક સારા વિચારની તાકાત વધારે છે.

રોગ ત્યારે આવે છે જ્યારે પુણ્યબળ ઘટે છે. સારા વિચારોથી પુણ્યબળ વધે છે. વિપરીત પરિસ્થિતિમાં સારા વિચારો કરવાથી મજબુત પુણ્યબંધ થાય છે. સારા વિચારો આપણા પરિણામને શુદ્ધ કરે છે. સરવાળે અનુબંધ શુભ બને. પુણ્ય સામગ્રી આપે. પુણ્યાનુબંધ પરિણાતિ આપે. શાલિન્દ્રને સંયમનો વિચાર પુણ્યાનુબંધે આપ્યો. પરિણાતિ અશુભ કરમની તાકાતને તોડી દે છે.

સારા વિચારની સહૃથી મોટી તાત્કાલિક અસર કરતી તાકાત છે કે - તે કલેશને દૂર કરે છે. કલેશ આર્તધ્યાનથી જન્મે છે. સારા વિચારો શુભધ્યાનની ભૂમિકા સરજે છે. કલેશ જાણાતો નથી. મનને હંમેશા સારા વિચારોમાં પરોવેલું રાખશો.

॥ એँ ॥

ધર્મલાભ,

ભાવના :

મને કેન્સર છે. મને તેની પીડા થાય છે. રોગ અને તેની પીડા આ બંનેનો હું મનથી સ્વીકાર કરું છું. મને રોગ સામે કે પીડા સામે કોઈ વાંધો નથી.

મને પીડા થાય છે. મારાથી તે સહન થતી નથી. તે હું જાણું છું. આ દુનિયામાં કેટલા માણસોને કેન્સર હશે ? કેટલાયને તો મારા કરતા ગંભીર બિમારી હશે. પારાવાર પીડા હશે. જીવી ન શકે, મરી પણ ન શકે એવી તેમની દશા હશે. આ પીડાને તેઓ કેવી રીતે સહેતા હશે ? મારી પીડા તો તે સામે કંઈ જ નથી.

મારે કેન્સરથી મુક્ત થવું છે. એ માટે કે હું મારી જિંદગીમાં વધુ આરાધના કરી શકું. મારે એકલાને રોગ મુક્તિ નથી જોઈતી. હું ચાહું છું કે - આ વિશ્વમાં જેટલા પણ કેન્સરના દરદી છે તેમનું દઈ ઓછું થાય, તેમની પીડા ઘટે, તેમને સ્વસ્થ અને સારું જીવન મળે. કમ થી કમ મોત સારું અને સહજ મળે. મારી આ ભાવના સફળ થાય તેવી શક્તિ મને મળે.

આ વિશ્વમાં જ્યાં ક્યાંય પણ અરિહંત પરમાત્માની ભાાવકરુણા વરસી રહી છે તેના પ્રભાવે સારું વિશ્વ દુઃખમુક્ત, રોગમુક્ત અને કર્મમુક્ત બને.

૧૫-૨-૨૦૧૧

॥ એ ॥

ધર્મલાભ,

શાતા હશે.

પરમાત્મા શ્રી મહાવીરદેવને છચ્છસ્થકાળમાં એક વ્યતીરીઓ ઉપસર્ગ કર્યો હતો. શિયાળામાં મહામહિનાની હંડી રાતે પ્રભુ એક ઝાડ નીચે કાઉસ્સણમાં ઊભા હતા. તેમની પર હંડાગાર પાણીના ટીપાં દેવી પાડતી હતી. એકેક ટીપું શરીરના જે ભાગ પર પડે તે ભાગને દંડાડી દેતું. ભગવાનનું ધ્યાન એ તરફ જતું. ભગવાન વિચારતા - ‘આ દેવી પૂર્વભવમાં મારી આણમાનિતી રાણી હતી. તેના મનમાં મારા પ્રત્યે દ્રેષ જાગ્યો હતો તે આજે આ સ્વરૂપે બહાર આવે છે. મારો દ્રેષ અશાતાના રૂપમાં બહાર આવે છે. આ ઉપસર્ગના બહાને બંને ખપી રહ્યા છે. તે બલે શરીરને પીડી. મારા મનને, મારા આત્માને, મારા ધ્યાનને તેની કોઈ પીડા નથી. હું સહજ ભાવે તેને જોઉં છું. તેને સ્વીકારું છું. હું મારી કાયાનો ત્યાગ કરી આત્મામાં લીન બની જાઉં તો કાયાની પીડા મને વ્યથિત કરતી નથી. જ્યાં સુધી આ ઉપસર્ગ છે હું - ઠાળેણ મોણેણ જ્ઞાણેણ અપ્પાણ વોસિરામિ - મારા શરીરને વોસિરાવું છું.

અદ્ભુત પરિણાતિ છે, પ્રભુની. પ્રભુની સાધનાનો નિયમ છે -

‘સ્વીકાર કરો, સામનો નહીં.

સમજ લો, સંઘર્ષ ન કરો.’

તમે જો તમારા આત્મામાં સ્થિર હશો તો કોઈ પીડા તમને પરેશાન કરી શકશો નહીં.

મનને સમજ અને સત્ત્વથી ભરી દેતી પરિણાતિ વરસાવતી પ્રભુકૃપા તમને ગ્રામ થાવ.

મ.વ. ૧૧

॥ એ ॥

આત્માનો વિચાર કરવાથી શરીરની વેદના ઓછી થાય છે અને કર્મની - ખરાબ કર્મની - તાકાત તૂટે છે. કર્મની તાકાત તૂટવાનો અનુભવ આત્માનો આનંદોત્સવ છે. કર્મની તાકાત તૂટી હોય ત્યારે આત્મા પ્રસંગતાનો અનુભવ કરે છે. આ પ્રસંગતાનું નામ જ સમાધિ છે.

રોગ જાય તો મનને પ્રસંગતા મળે તે સ્વસ્થતા છે.

રોગનું કારણ કર્મ જાય આત્માને પ્રસંગતા મળે તે સમાધિ છે.

આરાધનાનો સાર આ જ છે.

આત્મા સમાધિમાં રહે છે - આરાધનાથી. આરાધના એટલે શુભ આલંબનોનો મનથી સ્વીકાર. શુભ આલંબનોના સ્વીકારથી આત્મા દરેક અવસ્થામાં સ્વસ્થ રહે છે.

રોજ આપડો આપડી જાતનું આત્મનિરીક્ષણ કરવું કે ‘હું આરાધક દું કે વિરાધક ? મારી કેટલી પળ આરાધનામાં વીતે છે અને એટલી પળ વિરાધનામાં વીતે છે ?’

આરાધના માટે શુભ આલંબન ખૂબ જ જરૂરી છે. મનથી શુભ આલંબનને પકડી રાખવું પડે છે. વિચારવું કે - ‘મેં આખા જીવનમાં શું શું આરાધના કરી છે ? જે આરાધના કરી છે તે મારા આત્મા માટે હમણાં ઉપયોગી બને. મારી આરાધનાના પ્રતાપે મારા દુઃખોનો ક્ષય થાય, દુઃખનાં કારણ કર્મોનો ક્ષય થાય, મને સમાધિ મળે અને સમાધિનું કારણ સમ્યાદર્શન મળે.’

પ્રાણ નીકળી જાય તેવા ઉપસગો વચ્ચે અડોલ રહેનારા મહાપુરુષો આ જ ઉપાય અજમાવતા હતા. મનને શુભ આલંબન આપી દેવાનું અને આખી જિંદગીની આરાધનાની તાકાત તેમાં જોડી દેવાની.

વેદના થાય ત્યારે મને શુભ વિચાર આવે. ભગવાનની પૂજા કરતી વખતે જે શુભ

આવ આવ્યા તેવા શુભભાવ મને આ વેદનામાં પણ આવે.

પ્રતિક્રિયા કરતી વખતે જે શુદ્ધતા અનુભવી તે મને આ સમયમાં અનુભવાય.

સ્વાધ્યાય કરતા, વાંચન કરતા, જિનવાણીનું શ્રવણ કરતા જે એકાગ્રતા સધાર્ય હતી તેવી એકાગ્રતા પીડા વચ્ચે પણ ટકી રહે.

‘શરીર રોગમુક્ત થાય,

મન દોષમુક્ત થાય અને

આત્મા કર્મમુક્ત બને.’

મારી તમામ આરાધનાના ફળ સ્વરૂપે મને સમાધિ મળી રહે. મન ધર્મ-ધ્યાનમાં દૂબેલું રહે. કદાચ શરીરની પીડા ઓછી ન થાય તો પણ મારી આરાધના અખંડ રહે.

પૂર્વના જબરદસ્ત પુણ્યથી આટલી ઊંચી ભૂમિકામાં સ્થાન મળ્યું છે. પ્રભુનું શાસન મળ્યું, સારા ગુરુઓ મળ્યા, ધર્મની સમજ મળી, અનુકૂળ સ્વજનો મળ્યા, સારા વિચારોની સામગ્રી મળી. હવે નાની ભૂલ કરીને મારે મારી આરાધનાને ખોવી નથી. આરાધનાને અખંડ રાખવી છે. આરાધનાને આગળ વધારવી છે. આરાધના હશે તો પ્રભુ સુધી પછોંચી શકાશે. શરીરના રોગ કે પીડા મારા આરાધકભાવને ખંડિત કરી ન જાય તેટલી જાગૃતિ કેળવવાની છે. મારે આરાધક બનવું છે વિરાધક નહીં.

આ ભાવનામાં રમતા રહે.

૭-૫-૧૧

॥ એ ॥

### ધર્મલાભ.

ફાગ્યા સુદ તેરસના દિવસે શત્રુજ્યની છ ગાઉની પરિકમા થાય છે. તેમાં ચિકાણ તલાવડી આગળ સૂતાં સૂતાં કાઉસસગ કરવાનો મહિમા છે. કહેવાય છે કે - આ દિવસે એક ગુરુભગવંત બાળમુનિ સાથે યાત્રા કરી રહ્યા હતા. બાળમુનિને અસહ્ય તરસ લાગી. તેમણે ગુરુભગવંતને કહ્યું. ગુરુભગવંતે પોતાના જ્ઞાનથી જોયું કે તળાવનું કેટલુંક પાણી સૂરજના તાપથી અચિત થયું છે. તેમણે બાળમુનિને તળાવના પાણીથી તરસ છીપાવવા કહ્યું. તેમને કહ્યે બેસાડી તેઓ આગળ નીકળી ગયા. કહ્યે બેઠા બાળમુનિ વિચારે છે.

‘પાણીમાં અસંખ્ય જીવો છે. મારી તરસ છીપાવવા હું તેમની વિરાધના કરીશ ? તરસ તો છીપાઈ જશે પણ મને પાપ લાગશે તેનું શું ? તરસ થોડી વાર માટે મટશે, ફરી લાગશે પણ તે માટે કરેલું પાપ કેવી રીતે મટશે ? તે પાપ મીટાવવા આ ભવમાં કે આવતા ભવમાં ફરી તરસ સહન કરવી જ પડશે. ત્યારે સમજ નહીં હોય તો આર્તધ્યાન થશે અને કર્મોનો અનુબંધ ખરાબ પડશે. તે કરતા અત્યારે સમજ અને સમતાપૂર્વક સહન કરી લાઉં તે સારું ને ?’

‘આ શરીરને ગમે તેટલું સાચવીશ તો પણ તે તરસ્યું જ રહેવાનું છે. શરીરનો સ્વભાવ જ છે - માંગવાનો અને માંગયા પછી બગાડવાનો. ખોરાક-પાણી-વસ્ત્ર-વિલેપન જે કંઈ આપો શરીર તેનો મળ બનાવી દે છે. શરીરને જે આપો તે બગાડે. છેદે પોતે બગડી જાય. શરીરને જેમ સાચવીએ તેમ સુંવાળું થતું જાય. થોડું સહન કરવાની આદત પાડીએ તો શરીર સરખું ચાલે. શરીરની આળપંપાળ ઘણી કરી. શરીર ચાલતું નથી અને શરીર ચલાવવા પાપ કરવું નથી.

માંડ માંડ આત્માની સમજણ મળી છે તે મારે ગુમાવવી નથી. ભલે શરીરનું જે

થવાનું હોય તે થાય હું મારા આત્માને સાચવીશ. આત્મા જ મારો સાચો ભિત્ર છે. શરીર તો મરણ સાથે છૂટી જશે પછી તો આત્મા જ આવશે. શરીર માટે કરેલા પાપ અને આત્મા માટે કરેલા પુણ્ય જ આવશે. હું શરીર નથી પણ આત્મા હું. તો શરીરની આટલી ચિંતા શું કામ કરું? મારી પીડા મારે જ ભોગવવાની છે. આજે નહીં તો કાલે. તો આજે જ સમજુને સહન કરી લાઉં.’

જીબ સુકાઈને રબર જેવી થવા લાગી. આંખે અંધારા આવી ગયા. બાલમુનિ ત્યાં પથથર પર જ સૂર્ય ગયા. માનસિક અનસન સ્વીકારી લીધું. શરીરમાં પાણી ઘટવા લાગ્યું. આંખો અને મગજ નબળા પડ્યા. આખું શરીર તંત્ર ખોરવાઈ ગયું. પણ બાલમુનિનો સંકલ્પ અડગ રહ્યો.

‘ગમે તેટલી તરસ લાગે સહન કરીશ. ગમે તેટલી વેદના થાય સહન કરીશ. વિરાધના નહીં કરું. મારે જીવોને બચાવવા છે. મારે મારા આત્માને બચાવવો છે. થોડી તરસ સહન કરવામાં પાપથી બચી જવાનો મોટો લાભ છે. શરીર છે તો પાપ છે ને? શરીર મટીને સિદ્ધ થઈ જાઉં તો ભૂખ નહીં, તરસ નહીં, શાસ નહીં, વેદના નહીં, પાપ નહીં. મારે સિદ્ધ થવું છે. મારા કર્મો ખપી રહ્યા છે.’

ભાવની ઉત્કૃષ્ટ ધારામાં ચિત્ત લય પામ્યું. અપૂર્વકરણ થયું. ઘાતી કર્મ ખપાવી કૈવલ્ય પ્રાપ્ત થયું.

સમજ વેદનાને પણ સાધનામાં ફેરવી દે છે. આવી સમજ અકબંધ રહે એ જ શુભકામના.

૧૮-૩-૧૧

॥ એ ॥

ધર્મલાભ...

શાતા હશે. શરીરમાં વેદના છે. મનમાં ઉચાટ નહીં હોય તો આત્મા સમાધિમાં રહેશે.

હમણાં શ્રી રત્નસિંહ સૂ.મ.નું કુલક વાંચું છું. તેના શલોકનો અર્થ લખી જાણાવું. વેદના સહન કરવા મનમાં સ્થિરતા જોઈએ. મનને સ્થિર કરવા ધીરજ જરૂરી છે. આશાસન જરૂરી છે. મહાપુરુષોના શબ્દો દ્વારા આપણને તે મળે છે. આ શબ્દો તેમની અપાર કરુણાનો સ્પર્શ લઈને આવે છે.

(૧) ‘તું સુખી હોય કે દુઃખી, તારે લાંબું જીવવાનું હોય કે ટુંકું તેની ચિંતા ન કર. જો જ્ઞાતિ સાથે મરણને સાધી લેવાની કળા તારી પાસે આવી ગઈ હોય તો ફિકર કરવાની કોઈ જરૂર નથી. મૃત્યુની ફિકરથી મુક્ત થઈ જઈશ તો રોગ પરેશાન નહીં કરે. મોતનો ડર જ સહુથી મોટો રોગ છે.’

(૨) ‘આ પહેલા સંસારમાં તને અનંત મનુષ્ય જન્મ મળ્યા છે. તે બધામાં આ જન્મ સર્વશ્રેષ્ઠ છે કારણ કે – આ ભવમાં તને અનંત સુખના ધામ એવા મોક્ષને પ્રાપ્ત કરવાની સામગ્રી મળી ગઈ છે. આ ભવમાં તને આત્માની ઓળખ થઈ ગઈ છે. એટલે ધીરજ રાખ. તારું નામ અમર કરી દે. (નામ અમર થાય કે ન થાય આત્માને અમર કરી દે.)’

(૪) કેટલાક જન્મમાં બીજાના હાથમાં જવાથી, પરવશ હોવાને કારણે તે કેટલાંય દુઃખો સહન કર્યા છે. કૂકડાના ભવમાં કોઈના હુથે મરાયો. ક્યારેક જીવતો શેકાયો. ક્યારેક કોઈ અજગરના મૌંડામાં જીવતા ગળાયો. કોઈના પગ નીચે ચગદાયો. રોગ, ધા, ભાર અને મારની પારાવાર પીડા સહન કરી તેં જીવવા જ પ્રયાસ કર્યો. તેની સામે આજની પીડા કંઈ નથી. આ વેદના સામે લડ. વેદના તને દુઃખી કરે અને તું ડરતાં ડરતાં કે રડતાં રડતાં સહન કરે તે તારી હાર હશે. હસતાં હસતાં વેદના સહન

કરે તો તારી જિત છે.

(૫-૬) પીડાને કારણે તારું મન વ્યાકુળ બની ગયું હોય તો પણ કાન દઈને મારી એક વાત સાંભળ ‘લાંબા જીવનની આશાથી માણસ લીમડાનો કડવો રસ આંખો બંદ કરી હિંમતથી પી જાય છે. તેમ આ વેદનાના અનુભવનો કડવો રસ હિંમત કરી ગળી જા. પછી જીવન જ જીવન છે.’

‘તને શુભભાવ ગ્રામ થાય તે માટે પાંચ પરમેષ્ઠિને યાદ કર એ તને વેદનામાં હિંમત આપશો. કુટુંબનો મોહ છોડી દે. સતત આ વાતનો વિચાર કર.

‘પ્રભુનો ધર્મ મારું શરણ છે.

ભાવથી ગુરુના ચરણોમાં મારું મસ્તક જુકવું છું.

સંસારના બધા જ જીવો મારા મિત્ર છે.

હું મારા દુષ્કૃતનો સ્વીકાર કરું છું.’ (૭-૮)

બાકીના આઠ શ્લોકો હવે પછીના પત્રમાં...

તમને કાગળ લખું છું તો મારા મનની અશાંતિ દૂર થાય છે.

ફા. વ. ૮

॥ એ ॥

શાતા હશે.

પડી ગયેલું કે ડરી ગયેલું બાળક રડવા માટે અને તેની માતા તેને ગોદમાં લઈ માથા પર હાથ પસરાવી સમજાવે તે રીતે શ્રી રત્નસિંહ સૂ. મ.સા. રોગની વેદનાથી અને મૃત્યુના આતંકથી ગભરાઈ ગયેલા આત્માને વાત્સલ્યથી ધીરજ બંધાવે છે. તેઓ કહે છે -

(૮) ‘આખી જિંદગી આરાધનાના ફળ સ્વરૂપે તેં આ જ તો માંગ્યું છે. રોગમાં સમાધિ રહે મરણ સમયે જાગૃતિ રહે. રાધાવેદ કરવા જેવું આ કામ સાધીને વિજેતા બન. ચહેરો હુસતો રાખ.’

(૯૦) ‘આ સમયમાં તારા મનમાં ભાવના સાથે એક નવકારમંત્ર પણ હશે ને તો સદ્ગતિ અને સિદ્ધિગતિ તારા હૃથમાં છે એમ સમજ.’

(૯૧) ‘પ્રભુના વચનોથી ભાવિત થઈને મનને એકાશ કરી તું આજે તારા કર્મના ઉદ્યને અનુભંધ રહિત બનાવવા મહેનત કર. આ જ ધર્મનું રહુસ્ય છે.’

(૧૨-૧૩) ‘આટલા વરસમાં તેં જે દાન આપ્યું, લાંબું તપ કર્યું, શીલ પાણ્યું. ઘણાં શાસ્ત્ર સાંભળ્યાં, દેરાસર બંધાવ્યાં (પ્રભુભક્તિ કરી), શ્રદ્ધાપૂર્વક ગુરુના ચરણોની સેવા કરી આ બધા જ ધર્મનું ફળ એક જ છે. આજની ઘડીએ અશુભ ભાવોને પેદા કરનારી તાકાતનો મક્કમતાથી સામનો કર. ધીરજ રાખ. ડર નહીં. પ્રભુની કરુણા હુંમેશા તારી સાથે છે.’

(૧૪) ‘તને જે શુભત્ભાવોનું બળ મળ્યું છે તેનો ઉપયોગ કરવાનો આ

સાચો સમય છે. આરાધનામાં મનને લીન રાખ. મનમાંથી ડર હળવો થશે. પણ ધ્યાન રાખજે મન બહુ ચાલાક છે. ડરની જગ્યા લાલચ લઈ લેશો. શુભભાવોના પ્રતાપે મને મનુષ્યભવમાં કે સ્વર્ગમાં સુખ-સુવિધા મળે તેમ ન ઈચ્છાતો. બધા જ સુખનું મૂળ સમતા છે. તેની ઈચ્છા કરજે. સમતાનો સ્પર્શ મોક્ષનો અનુભવ છે.'

(૧૫) 'આવતા ભવમાં મને તીર્થકર ભગવંતનું શરાણ મળો.

ગુરુભગવંતનું સાનિધ્ય મળો.

ધર્મની ઉત્કટ શક્તા મળો.'

આ વિચાર કરજે. તારા નિષ્કામ શુભભાવ તને સમસ્ત રોગના કારણ એવા કર્મથી મુક્તિ અપાવશે.'

(૧૬) 'આ રીતે સમજદારી કેળવી આરાધના કરીશ. મનને સ્થિર રાખીશ તો આ વિશ્વમાં એવી કોઈ તાકાત નથી જે તને તારા કલ્યાણથી દૂર રાખે.'

પૂજ્ય આચાર્ય ભગવંતના કરુણાપૂત શબ્દો તમને શુભભાવો સર્જવામાં સહાયક બનો.

ફા.વ. ૮/૧

॥ એ ॥

ધર્મલાભ,

જીવનમાં આપણાને એક શાસ લેવા મળે છે તે પણ ભારે પુણ્યનો ઉદ્ય છે. પુણ્યની મદદ વિના નિરાંતે એક શાસ પણ લઈ શકતો નથી. શરીરમાં રોગ છે, અશાના છે પણ રોગને કારણે જીવન જતું રહ્યું નથી. આ આપણું ખુલ્લું મોટું નસીબ છે.

આપણી વર્તમાન પળ વેદનામય છે તે આપણો પાપોદ્ય છે. સાથે જ વર્તમાનપળમાં આપણે છીએ તે બહુ મોટી વાત છે. ભલે આપણા વર્તમાનને ભૂતકાળના પાપે બગાડી મૂક્યો હોય. પણ તે જ વર્તમાનની સાથે આપણે શુભવિચાર ટકાવી રાખીએ તો ભવિષ્ય બગડતું અટકી જાય. એટલું જ નહીં સુધરવા પણ માર્દ. આપણો એક જ લક્ષ્ય જાગૃત રાખવાનું - પાપથી બગડેલી વર્તમાન પળને પુણ્યમયી બનાવવાની, જેથી આપણું ભવિષ્ય સુધરે.

આપણા શરીરમાં રોગ છે, મગજમાં વેદના છે, મનમાં સંતાપ છે. લાંબો સમય સુધી ચાલનારા રોગ-વેદના-સંતાપનો એક સાથે હૃતાવવો અધરો છે. જેમ સો લાકડીનો ભાર આપણે એક સાથે ઉઠાવી શકતા નથી તો એક-એક લાકડી ઉઠાવીને ભાર હલકો કરવો રહ્યો. તે જ રીતે બે મહિનાની કે ચોવીસ કલાકની વેદનાના સંતાપને આપણો એક સામટો મનમાંથી દૂર કરી શકતા નથી તો તેના વિભાગ પાડી દઈએ. જેટલો ટાઈમ રોગ છે તેટલો ટાઈમ સંતાપથી દૂર રહેવું અધરું અને કદાચ અશક્ય છે તો તેના વિભાગ પાડી દઈએ.

એવું નક્કી કરીએ કે મારી વેદના પાંચ કલાક ચાલવાની છે તેનાથી મને સંતાપ તો થશે પણ તું દર કલાકની પાંચ મિનિટ સંતાપથી બચીશ, શુભ વિચાર કરીશ. પાંચ મિનિટ સંતાપથી બચવું સહેલું છે અને શક્ય પણ. પાંચ કલાકમાં પચીસ મિનિટ સંતાપ રહિત વીતે તેનાથી મનની જે પ્રસરતા મળે છે તે બાકીના સાડા ચાર કલાકને મજેથી

પસાર કરાવી દે છે.

પાંચ ભિનિટ સમતા રાખવા શું કરવું ? તે પહેલેથી વિચારી લેવું. જે યોગ આપણાને સહૃથી વધુ પ્રિય હોય તેમાં દૂબી જવું.

દુશ્મનના સકંજામાં ફસાયેલા માણસને પાંચ ભિનિટ મુક્તિ મળે ત્યારે તેને કેટલી ખૂશી થાય ? સંતાપના સકંજામાં ફસાયેલા મન પાસે આપણે પાંચ ભિનિટની મુક્તિ માંગવાની. આ પાંચ ભિનિટમાં રોગ યાદ નહીં કરવાનો. શુભ ભાવોને જ યાદ કરવાના. આ જ માર્ગ છે પ્રસંગતાનો.

વિરતિફળકુલક નામનું શાસ્ત્ર કહે છે - ‘આપણો એક પણ શાસ પુરુષ કે પાપ વિનાનો નથી. દિવસમાં જેટલા શાસ લઈએ તેમાંનો એક શાસ પણ પુરુષનો હોય તો એ મોટો લાભ છે.’

તમારી સમતા અને પ્રસંગતા નિરંતર વધ્યા કરો.

ચૈ.સુ. ૨

॥ ऐँ ॥

धर्मलाभ,

आपણું જીવન શરીર દ્વારા ચાલે છે. પણ શરીર જીવન નથી. આપણે ગાડી દ્વારા એક સ્થળોથી બીજે સ્થળે જઈએ પણ ગાડી એ પગ નથી. શરીર જીવન જીવવામાં સહાયક છે, જીવનનું સર્વસ્વ નથી. જીવનનું સર્વસ્વ આત્મા છે. કબીરજીનું એક પદ છે.

કચા તન માંજતા રે એક દિન મિઠીમેં મિલ જાના.

મિઠી મેં મિલ જાના બંદે, ખાખ મેં ખપ જાના.

આપણે જે ઘરમાં રહીએ છીએ તે ઘર માટીમાંથી બને છે માટે હક્કિકતમાં માટીનું છે. પણ આપણે જીવનભર આ ઘર મારું-મારું કરતા રહીએ છીએ. એક દિવસ ઘર છોડવું પે ત્યારે દુઃખ થાય છે. ઘરની જેમ જ શરીર પાંચ ભૂતની માટીમાંથી બનેલું છે. જીવનપર્વત આ શરીરને મારું મારું કરી સાચવીએ. આખર મૃત્યુ આપણને (= આત્માને) શરીરમાંથી બહાર કાઢી લે છે. શરીર પુદ્ગલથી બને છે, પુદ્ગલથી વધે છે, પુદ્ગલથી સચવાય છે અને પુદ્ગલથી જ બગડે છે અને પુદ્ગલનો એક જ સ્વભાવ છે - પરિવર્તન. સારાંને ખરાબ કરવું, ખરાબને સારું. સતત પરિવર્તનશીલ એવા પુદ્ગલથી બનેલા શરીરને આપણે અમર માની બેઠા છીએ. આ ભ્રમણા આપણા દુઃખનું મૂળ કારણ છે.

ચોવીસ કલાક આપણે શરીરનો જ વિચાર કરીએ છીએ, આત્માનો નહીં. આજ સુધી આપણે જેટલો વિચાર શરીરનો કર્યો તેટલો આત્માનો કર્યો હોત તો આજે આપણે મોક્ષમાં હોત.

શરીરનો વિચાર કરવાથી રોગની પીડા સત્તાવે. આત્માનો વિચાર કરવાથી રોગની પીડા ભૂલાય. એટલું જ નહીં રોગ અને તેનું મૂળ પાપકર્મ બંને નબળાં પડે. કદાચ અશાતા વેદનીયનો ઉદ્ય મજબૂત હોય તો પણ રસ ઘેટે = તેની અશુભતા ઘેટે તેથી પ્રસમતા સહજ બની રહે. રોગમાંથી કાયમ માટે મુક્તિ મળે.

આત્મા વિષે કુલ છ મુદે વિચાર થઈ શકે.

એક, હું ભવ્ય છું કે અભવ્ય ?

અભવ્ય જીવને ક્યારેય સમાધિ મળે નહીં. સુખ મળે, સમાધિ ન મળે. મોક્ષનો વિચાર પણ તેને ન આવે. સતત કલેશમાં રહેવું એ તેની માનસિકતા હોય. જ્યાં મોક્ષનું વાતાવરણ હોય ત્યાં તે પહોંચે જ નહીં. અભવ્ય શત્રુજ્ય ન જઈ શકે. આ ઉપરાંત તેને ‘હું મોક્ષમાં જઈશ કે નહીં’ એવી જિજ્ઞાસા ન જન્મે. મોક્ષ વિષે તને શ્રદ્ધા જ ન હોય.

ભવ્ય હોવાની બે નિશાની છે. એક શત્રુજ્યની સ્પર્શના. બે, મોક્ષમાં જવાની થોડી ઘણી ઊંડી ઊંડી પણ ઈચ્છા. આ બે આપણે પામ્યા છીએ એટલે આપણે ભવ્ય છીએ તે ચોક્કસ.

કેટલા આનંદની વાત છે ! આપણે મોક્ષમાં જઈ શકીએ છીએ. આપણે સિદ્ધ બની શકીએ છીએ. વહેલા મોડા પણ આપણે મોક્ષમાં જવાના એ નક્કી. આ ભવમાં મળેલી સમજનો સદ્ગુપ્યોગ કરી લઈએ તો આપણે મોક્ષની નજીક જઈ શકીએ. મોક્ષમાં ક્યારે જઈ શકશો ? એની ખાત્રી આપણી પાસે નથી. પણ ભવ્ય જ છીએ એ ખાત્રી તો આપણી પાસે છે જ છે. હવે વાર કેવળ પુરુષાર્થની છે. આપણનું ભવ્યત્વ જાગૃત થાય તો આપણો મોક્ષ નજીક. ભવ્યત્વને જાગૃત અને સક્રિય કરવાના ત્રણ ભાવ મેં તમને પહેલા દર્શાવ્યા છે. સુકૃતની અનુમોદનાનો ભાવ, દુષ્કૃતની નિંદાનો ભાવ અને પરમેષ્ઠિ પ્રત્યે સમર્પણનો ભાવ.

આ ત્રણ ભાવ આપણે મનથી કરી શકીએ છીએ. મનને આ ત્રણ ભાવોમાં લયલીન રાખીએ ભવ્યત્વ જાગૃત થશો.

બાકીના મુદ્દા હવે...

ચૈ. સુ. ૧૦

॥ એ ॥

શાતા હશે.

આત્મા વિષે વિચાર કરવાનો બીજો મુદ્દો છે - 'હું લઘુકર્મી હું કે - ભારેકર્મી ?'

સારા વિચાર, સારી ભાવના અને સારી કિયા લઘુકર્મી જીવ જ કરી શકે છે. મજબૂત અનુબંધવાળા કર્મ દાખિને ખોટી બનાવે છે, રાગદ્વિષને મજબૂત બનાવે છે, સ્વાર્થી બનાવે છે. કર્મો હળવાં થાય તો સંવેદના જન્મે છે. લઘુકર્મિતાને ઓળખવાની ત્રણ નિશાની છે -

એક - લઘુકર્મી જીવને દુઃખી વ્યક્તિઓને જોઈ દ્યા જન્મે.

બે - લઘુકર્મી જીવને ગુણવાન વ્યક્તિઓને જોઈ આનંદ થાય, દ્વેષ ન થાય.

ત્રણ - લઘુકર્મી જીવ બીજાનું સંભાન સચ્યવાય તેવું વર્તન કરે.

લઘુકર્મી થવા કર્મસત્તાની સહાય અપેક્ષિત છે. અનાદિકાળથી રખડતાં રખડતાં કર્મોનો માર સહન કરતા કરતા અનાયાસે જ કર્મની સ્થિતિ પાતળી પડી જાય ત્યારે દ્રવ્યથી ભગવાનનું શાસન મળે, નવકાર મંત્ર મળે. ભારે કર્મો જીવોને નવકાર પણ ન મળે. અભવી, દૂરભવી, ભારેકર્મી ભવી જીવ ભાવથી ધર્મ ન પામી શકે. કર્મની સ્થિતિ પાતળી પડે, આપણામાં રહેલું ભવ્યત્વ જાગૃત થઈ રહ્યું હોય ત્યારે ઉપર રહેલા ભાવ આવે.

આપણે નસીબદાર છીએ કે આપણામાં સંવેદના જીવિત છે. આ સંવેદનાને સાચી સમજનો સ્પર્શ મળ્યો છે. તેથી આપણને સારા ભાવ આવે છે. આ ભાવ આપણાં પાપ કર્મોને વધુ નબળાં બનાવે છે. કર્મો નબળાં પડતાં સારા ભાવ ઓર ખીલે છે. નબળાં પડી રહેલા કર્મો બેચેન બની આપણને પરેશાન કરી શકે છે. કેમ કે - સારો ભાવ કર્મસત્તાનો કહુર દુશ્મન છે. આપણા આત્માને કબજામાં રાખવા કર્મસત્તા પીડા દ્વારા ભાવ પર આકમાણ કરે છે. આ સમયમાં આપણે નાસીપાસ થઈ જઈએ, તો સારા ભાવ જતાં રહે. કર્મો મજબૂત બની જાય. એટલે કે આપણે ફરી ભારેકર્મી બની જઈએ. સારા ભાવ આપણાને કર્મના સર્કારી બચાવે છે. આપણે તેને મહુત્વ આપવાનું છે. કર્મ આપણા શરીરપ્રેમનો ફાયદો ઉઠાવી સારા ભાવને મારી નાંખવા મથે છે. આપણે સારા ભાવને

ટકાવી રાખવાનો. શરીર તો પછી સારું થઈ જશે. નીરોગી શરીરને સારા ભાવનો સાથ નહીં હોય તો શરીર વધુ નુકસાન કરશે.

કેટકેટલા મહામુનિઓએ પ્રાણાંત પીડા સહન કરી સારા ભાવના સહારે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ?

કૃષ્ણા અને શ્રેષ્ઠ રાજાએ સારો ભાવ છોડી દીધો અને દુગ્ધિતમાં ગયા.

ભારેકર્મીપણું એ કેન્સરથી પણ ખરાબ અને ભયાનક રોગ છે. કેન્સર તો શરીરનો રોગ છે, ભારે કર્મીપણું આત્માનો. કેન્સર વીસ-પચીસ-પચાસ વરસ બગાડે; વધુમાં વધુ એક જિંદગી બગાડે, ભારેકર્મીપણું ભવોભવ બગાડે. કેન્સરની પીડા સીમિત હોય, ભારેકર્મીપણું તમને નરકની યાતના આપાવે છે. ભગવાનશ્રી મહાવીર પરમાત્માના આત્માએ અભિમાન અને શિષ્યલોભના પ્રભાવમાં આવી પોતાની લઘુકર્મિતા ખોઈ ભારેકર્મી બન્યા. કષાયોનો ભોગ બની નરકમાં ગયાં.

આપણી સારવાર શરીરના સ્તર પર કેન્સરની છે, આત્માના સ્તરે ભારેકર્મીપણાંની છે. આ રોગની એક જ દવા છે - સતત શુભભાવોમાં રહેવું. પીડાની વચ્ચે શુભભાવનામાં રહેવું. મનની સ્વસ્થતા ટકાવી રાખવી. પીડા અસદ્ય બની જાય ત્યારે થોડીવાર માટે મનમાં વ્યાકુળતા આવી જાય એ બને. ઢીક છે એટલા સમયને ભૂલી જઈ મનને પાછું શુભભાવનામાં રમતું કરી દેવાનું. ચાલતા ચાલતા પડી જવાય તો કપડાં ખંખેરી ફરી આગળ ચાલવાનું. કોઈ પણ ભોગે શુભભાવ ટકાવી રાખવાનો. શુભભાવ હુશો ત્યાં સુધી લઘુકર્મિતા છે અને લઘુકર્મિતા છે તો મોક્ષમાં જવાના આગળના દરવાજા ખુલા છે.

ચૈ. સુ. ૧૨

॥ એ ॥

### ધર્મલાભ.

આત્મા વિષે વિચાર કરવાનો ત્રીજો મુદ્દો છે - ‘હું માર્ગનુસારી છું કે નહીં ?’

કર્મો હળવાં થતાં પરિણામો કોમળ બને છે, દૃષ્ટિ સ્વચ્છ બને છે, દિશા બોધ રૂપદ્ધ થાય છે. લોકું ગરમ થઈને નરમ બને ત્યારે તેને ઘાટ આપી શકાય તેમ આત્માનો પરિણામ કોમળ બને ત્યારે તેને સાચી દિશામાં વાળી શકાય.

આપણા આત્માનું વહેણ અનાદિકાળથી સંસાર તરફનું છે. સંસાર એટલે આપણી ભીતરી ઈચ્છાઓ, મનઃકામનાઓ. તે વહેણને બદલીને આત્મા તરફ વાળવું હોય તો આપણી સૂતોલી યોગ્યતાને જગવવી રહી. કર્મ નબળાં પડે ત્યારે આપણે આપણા પરિણામોને વાળી શકીએ. આ સમયે આત્મશુદ્ધિની સાચી દિશા મળે, સાચો માર્ગ મળે તો આપણે ફાવી જઈએ. આપણું મન સંસારનાં વાંકાયૂકાં માર્ગ ચાલતું હતું તે આત્માના સરળ માર્ગ ચાલવા લાગે તે માર્ગનુસારિતા.

સુખ મેળવવા આત્માનો સીધો રસ્તો છોડી આપણે પદાર્થોનો વિચિત્ર રસ્તો પકડ્યો છે. તે જ આપણા દુઃખનું મૂળ છે. આત્માને સાચવવાના બદલે આપણે શરીરને સાચવીએ છીએ. શરીરના ભોગે પણ આત્મા સાચવવો જોઈએ. તેને બદલે આપણે આત્માના ભોગે શરીરને સાચવીએ છીએ. ગમે તેટલું સાચવીએ પણ શરીર આપણને સાચવતું નથી, હેરાન જ કરે છે. શરીરને જીવાડે છે આત્મા, ધતાં શરીર આત્માને હેરાન જ કરે છે. આ વાસ્તવિકતા સમજાય ત્યારે માર્ગનુસારિતા પ્રગટે છે.

શરીરને સાચવવું છે પણ આત્માના ભોગે નહીં.

સંસારને સાચવવો છે પણ આત્માના ભોગે નહીં.

સ્વજનોને સાચવવા છે પણ આત્માને ભૂલીને નહીં.

આત્મજગૃતિ સંસાર નામના રોગની એક માત્ર દવા છે. તેનું પ્રવેશદ્વાર માર્ગાનુસારિતા છે.

સતત વિચારજો કે - મને આત્માના વિચારો સરળતાથી આવે છે કે શરીરના ?

મને સુખના વિચારો સહજતાથી આવે છે કે સમતાના ?

મને પદાર્થના વિચારો વધુ આકર્ષે છે કે પરમાત્માના ?

આ વાતોની વૈચારિક સ્પષ્ટતા આપણા મનને અજબની રાહત આપે છે.

ત્રાશ વાતો વિચારવાની છે.

પાપ કરતી વખતે હું એટલી જાગૃતિ રાખી શકું છું કે - 'હું આ જે કરું છું તે ખોટું છે અથવા પાપ છે' - તો હું માર્ગાનુસારી છું.

સુખ ભોગવતી વખતે અનુકૂળતા પામતી વખતે હું જાગૃતિ રાખી શકું છું કે - 'આ સુખ તો બે ઘડીનું છે, શરીરનું છે.' તો હું માર્ગાનુસારી છું.

'ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ હું મારા મનના પરિણામોને એટલી હંદે પડવા દેતો નથી કે જેથી મારા અને બીજાના આત્માને નુકસાન થાય' - તો હું માર્ગાનુસારી છું.

તમને મળેલા અવકાશનો ઉપયોગ વધુને વધુ આત્મજગૃતિ કેળવવા કરજો.

ચૈ. સુ. ૧૪

॥ એ ॥

શાતા હશે.

શરીરમાં રોગ થાય તેની વેદનાનો અહેસાસ જાગૃત મન કરી લે છે. પણ આત્માને લાગેલા રોગનો અહેસાસ મનને થતો નથી. કદાચ આપણું અસ્તિત્વ આત્મમય છે એ વાતની ખબર જ નથી. ‘હું આત્મા નથી, શરીર જ છું’ આ ખોટી સમજનું નામ ભિથ્યાત્વ છે. આત્મા સુધી પહોંચવા આ ખોટી માન્યતાને તોડવી રહી. કર્મ નબળાં પે આત્મા લઘુકર્મી બને ત્યારે પહેલો વિચાર આત્માનો આવે. ‘હું કોણ છું ?’ ‘ક્યાંથી આવ્યો ?’ ‘ક્યાં જવાનો ?’

મારા જીવનમાં સુખ દુઃખ કેમ આવે છે ?

હું કેમ આવો છું ?

મારા શરીરને કોણ ચલાવે છે ?

વિચારોને કોણ દિશા આપે છે ?

લાગણીઓને કોણ તાણે છે ?

આ પ્રશ્નો તેના મનમાં જાગે છે - લઘુકર્મિતાને કારણે. કોઈ સદ્ગુરુ કે કલ્યાણમિત્ર દ્વારા ભગવાનની વાત સાંભળવા મળે ત્યારે તેને પોતાના સ્વરૂપની માહિતી મળે.

કર્મ કહે - ‘હું શરીર છું.’ ધર્મ કહે - ‘હું આત્મા છું.’

કર્મ કહે - ‘રાગમાં સુખ છે.’

ધર્મ કહે - ‘ત્યાગમાં સુખ છે.’

ઘણું સાંભળ્યા પછી, ઘણી મથ્યામણ કર્યા પછી પણ ખોટી માન્યતાને કારણે સાચી વાત હદ્યમાં ઉત્તરે નહીં. સાચી વાતને અંતર દ્વારા આત્મમાં ઉતારવાનો પ્રયાસ સમ્યક્તવની ગ્રામિનો ઉપાય છે. આ સંદર્ભમાં ‘હું સમકિતી છું’ કે ભિથ્યાદિ ?’ આ મુદ્દો ઉપસ્થિત થાય છે.

સમકિતનો પરિણામ આવ્યાની મુખ્ય બે નિશાની છે. એક - આત્માનો અનુભવ થાય. ‘હું આત્મા છું, શરીરથી જૂદો છું.’ એ વાત અનુભવમાં આવે. બે - આપણને આપણો મોક્ષમાર્ગ દેખાય. ‘હું આત્મા છું’ એ વાત સમજાઈ જય પછી સંસારને જોવાની

દુષ્ટ જ બદલાઈ જાય. સુખદુઃખની વ્યાખ્યા જ ફરી જાય. જીવનનું કેન્દ્ર બદલાઈ જાય. શ્રેણિક મહારાજને જેલની પીડા સત્તાવતી ન હતી તેનું કારણ સમકિત છે. સમકિત દુઃખને સહજતાથી સ્વીકારતા શીખવે છે. દુઃખ પર દ્વેષ થતો નથી. ‘દુઃખ મારાં કર્મથી આવ્યું છે અને મારે તે ભોગવવાનું છે. હસતાં હસતાં ભોગવીશ તો કર્મ ધૂટશે.’ સહનશીલતા ઓછી વધારે હોય તે બની શકે, ચાલી પણ શકે. સ્વીકારશીલતા ઓછી હોય તો પીડામુક્ત બનવાનો કોઈ ઉપાય નથી.

હું આત્મા છું, શરીર નથી.

હું આત્મા છું તેથી અમર છું, શરીર મરે છે હું નહીં.

હું આત્મા છું, સારા ખરાબ કર્મો હું કરું છું. શરીર તો તેનું સાધન માત્ર છે.

મેં કરેલાં સારા ખરાબ કર્મોનાં ફળ મારે જ ભોગવવાના છે.

હું ધારું તો મારાં ભૂતકાળના કર્મોથી મુક્ત થઈ શકું છું.

હું સંયમ અને જ્ઞાનને જીવનમાં ઉતારું તો મારો મોક્ષ નક્કી છે.

આ છ વાતની સ્પષ્ટ પ્રતીતિ સમકિત હોવાની નિશાની છે.

યાદ રાખો ! સમકિત સમજ દ્વારા પ્રગટે છે અને સમજ દ્વારા જ ટકે છે. સમજમાં ફેરફાર થયો તો સમકિતમાં ફેરફાર થઈ જાય છે. સમજ ટકે તો સમાધિ ટકે છે. સંયમની ઈચ્છા અને જ્ઞાનની ઈચ્છા આપણાં આત્માને વધુને વધુ શુદ્ધ બનાવે છે.

પાપ ગમે તેટલા હશે સમકિત આવશે તો મોક્ષ નક્કી છે.

દુઃખ ગમે તેટલા હશે સમકિત હશે તો સંસારનો અંત નક્કી છે.

દોષ ગમે તેટલા હશે સમકિત હશે તો શુદ્ધ નક્કી છે.

દર્દ ગમે તેટલા હશે સમકિત હશે તો સમાધિ નક્કી છે.

ચૈ.વ. ૨, ૧૯-૪-૨૦૧૧

આજ્ઞાધર્મથી અનુભૂત અને શબ્દશ્રીથી સમૃદ્ધ સાહિત્યનાં પ્રકાશન કરવામાં  
સમુદ્દર્ય સહયોગ આપનાર લાભાર્થી પરિવાર

### પ્રવચન સ્તંભ

શ્રી હેમતલાલ છગનલાલ મહેતા પરિવાર - કલકત્તા

શ્રીમતી પ્રભાબેન નંદલાલ શેઠ - મુંબઈ

યુવા સંસ્કાર ગ્રૂપ - નાગપુર

જ્યંતીલાલ માગેકચંદ કોડારી પરિવાર

ઉસ્તે - પ્રબોધભાઈ, વિરેન્દ્રભાઈ તથા ભરતભાઈ - મુંબઈ

શ્રીમતી કામાક્ષીબેન પ્રવિષુયંદ શાહ - (રાંદેર) હાલ - મુંબઈ

શ્રી મણિલાલ બેચરરાસ સાવરકુંડલા પરિવાર - વિલેપાર્લો, મુંબઈ

શ્રીમતી શોભનાબેન ચંદ્રકાંતભાઈ શાહ - જુહુસ્કીમ, મુંબઈ

ચંપાબેન જ્યંતિલાલ દાનસંગભાઈ અજબાણી - મુંબઈ

શ્રી તેજપાલભાઈ શશીકાંતભાઈ શાહ - મુંબઈ

નંદ્રમભા તીર્થભૂમિ ટ્રસ્ટ - પાલીતાળા

## પ્રવચન પ્રેમી

શ્રી સુધીરભાઈ કે. ભાગશાહી - કલકત્તા

શ્રી કુમારપાળ દિનેશકુમાર સમદિયા - મંચર

શ્રી શાંતિલાલ ગમનાજી રંકા (મંડારવાળા) - સાબરમતી, અમદાવાદ

આરટેક્સ એપરલ્સ - સાબરમતી, અમદાવાદ

શ્રી પ્રેમયંદ રવચંદ શાહ (કુણઘેરવાળા) - અમદાવાદ

શ્રી છગનલાલ તિલોકચંદ સંઘવી - સાબરમતી, અમદાવાદ

શ્રી અશોકભાઈ ઘેલાભાઈ શાહ - (જૈન મર્યાન્ટ સો.) અમદાવાદ

શ્રીમતી પન્નાબેન રમેશભાઈ - પાર્લી, મુંબઈ

હરીભાઈ મુળચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ - મુંબઈ

શ્રી વસંતભાઈ પી. કોઠારી (સી.એ.) - મુંબઈ

શ્રીમતી કુસુમબેન અમૃતલાલ શાહ - મુંબઈ

શ્રીમતી લલીતાબેન ગોવિંદજી શાહ, મુંબઈ

શ્રી શાંતીલાલ હરિલાલ મહેતા, મુંબઈ

શ્રીમતી મોનાબેન મયંક શાહ, મુંબઈ

શ્રી સમરથમલજી જીવાજી વિનાયકીયા (મોકલસર) - પૂના

સંઘવી વીરચંદજી હુકમાજી - પૂના

શ્રીમતી નાથીભાઈ બાબુલાલજી વીરચંદજી રાઠોડ - પૂના

## પ્રવચન ભક્ત

- શ્રી ચંદુલાલ નેમયંદ મહેતા - કલકત્તા  
શ્રી છોટાલાલ દેવચંદ મહેતા - કલકત્તા  
શ્રી ખુશાલચંદ વનેચંદ શાહ - કલકત્તા  
શ્રી રસોકલાલ વાડીલાલ શાહ - કલકત્તા  
શ્રી કસ્તૂરચંદ નાનચંદ શાહ - કલકત્તા  
શ્રી મંથાલાલ શામજી જોગાણી - કલકત્તા  
શ્રી ગુલાબચંદ તારાચંદજી કોચર - નાગપુર  
શ્રીમતી સમજુબેન માણીલાલ દોશી પરિવાર - નાગપુર  
ઉજાનિવાસી શ્રી નટવરલાલ પોપટલાલ મહેતા - નાગપુર  
શ્રી ગવીણચંદ વાલચંદજી શેઠ (ડીસાવાલા) - નાસિક  
શ્રી ચંદ્રશેખર નરેન્દ્રકુમાર ચોપડા - વરોરા  
શ્રી સુભાષુકુમાર વાડીલાલ શાહ - કરાઠ  
શ્રી પ્રકાશ બાબુલાલ, દેવેન્દ્ર, પરાગ, પ્રિતમ શાહ - મંચર  
શ્રીમતી હસમુખબેન જયંતીલાલ શાહ (પૃથ્વી) - વાપી  
શ્રી વિનોદભાઈ મણિલાલ શાહ - અમદાવાદ  
સ્વ. રંભાબેન ત્રિકમલાલ સંઘવી, હસ્તે - મહેન્દ્રભાઈ - આપણંદ  
શ્રી શેફાલી મૂર્તિપૂજંક જૈન સંઘના આરાધકો - અમદાવાદ  
પુખરાજ રાયચંદ પરિવાર - સાબરમતી, અમદાવાદ  
એક સદ્ગૃહસ્થ, હરજી (રાજસ્થાન)  
વોરા નાગરદાસ કેવળદાસ રિલિ. ટ્રસ્ટ - અમદાવાદ  
શ્રી લાંબડિયા જૈન સંઘ - લાંબડિયા  
શ્રી નથમલજી પ્રતાપચંદજી બેડાવાળા - સાબરમતી, અમદાવાદ  
શ્રીમતી રંજનબેન જયકુમાર શાહ - કેનેડા  
શ્રીમતી નીરુબેન ઉત્તમચંદ સોઢાણી - સાબરમતી, અમદાવાદ

શ્રીમતી રમીલાબેન બાબુલાલ રાયચંદ - વાપી  
શ્રી વેલચંદ જવાનમલજી ઓસવાલ - ચિપળૂણ  
શ્રીમતી લીલાબેન બાબુલાલ દેવીચંદજી વિનાયકિયા - તીરસા  
શ્રી પૂનમચંદ કસ્તૂરજી માંગોત પરિવાર - કુચાવાડા  
સુપુત્રો - કાળીદાસ - ધેવરચંદ - જેઠમલ  
સ્વ. સુવાબેન અમૃતલાલ દેવીચંદજી વિનાયકિયા પરિવાર - તીરસા  
શ્રીમતી સખિતાબેન વૃજલાલ પોપટલાલ દોશ્રી - (મહુવા) પાર્વતી, મુંબઈ  
શ્રી વિનોદભાઈ દોશ્રી, શ્રીમતી વસંતાબેન મનહરલાલ દોશ્રી - મુંબઈ  
શ્રી મહેન્દ્રકુમાર કાંતિલાલ ખાંડવાલા - મુંબઈ  
શ્રી કપૂરચંદજી ભબુતમલજી સોલંકી - મુંબઈ  
ડૉ. નરેન્દ્ર એમ. શાહ - ખામગાંવ  
સંઘવી રતનબેન ચુનીલાલ હુકમાજી - પૂના  
શ્રીમતી પ્રભાવતીબેન રમાણુલાલ શાહ - મુંબઈ  
શ્રીમતી જયશ્રીબેન ભૂપેન્દ્રભાઈ શાહ - મુંબઈ  
શ્રીમતી પત્રાબેન યોગેશભાઈ શાહ - મુંબઈ  
શ્રીમતી તુલસીભાઈ ધર્માજી - પૂના  
શ્રી હુંસરાજજી તારાચંદજી સંઘવી - પૂના  
શ્રી સંઘવી ખુમાજી માનાજી - પૂના  
શ્રી જૈન શૈતાંબર મૂર્તિપૂજક સંઘ ગુલટેકડી - પૂના  
શ્રી સંઘવી ગાણેશમલજી વક્તાજી - પૂના

## સાહિત્ય-સૂચિ

- |   |  |
|---|--|
| <p>૧. સ્તુતિસરિતા (ચોથી આવૃત્તિ)</p> <p>૨. ગુણાનુવાદ પ્રવચન</p> <p>૩. રામયંકન નમામિ</p> <p>૪. સાધુ તો ચલતા ભલા<br/>(ભાગ - ૧/૨)</p> <p>૫. પ્રભુ ! ક્યારે કૃપા કરશો</p> <p>૬. ફૂલ નહીં તો પાંખી</p> <p>૭. પર્વ પ્રવચન (બીજી આવૃત્તિ)</p> <p>૮. પ્રસંગતાની પાંખો</p> <p>૯. મોતીએ બાંધી પાળ</p> <p>૧૦. ચપટી ભરી ચોખા</p> <p>૧૧. ચાહે તો પાર કરો (હિંદી)</p> <p>૧૨. બાળકોના જીવિચાર<br/>(ગુજરાતી/હિંદી)</p> <p>૧૩. ક્ષમાભાવના</p> <p>૧૪. આનંદધનઅષ્ટપદી</p> <p>૧૫. કોધને જીતવાનો માર્ગ<br/>(ગુજરાતી / હિંદી / મરાಠી)</p> <p>૧૬. મારા મનગમતા વિચારોની ડાયરી</p> <p>૧૭. વહેલી સવારનો શંખનાદ</p> <p>૧૮. અનહુદની આરતી</p> | <p>૧૯. એક દીવાની જ્યોત</p> <p>૨૦. જગ સપને કી માયા</p> <p>૨૧. શબ્દે શબ્દે શાતા</p> <p>૨૨. જીવનની સપ્તપદી<br/>(ગુજરાતી / હિંદી)</p> <p>૨૩. વંદના</p> <p>૨૪. મૃત્યુની ભાવયાત્રા<br/>(ગુજરાતી / હિંદી)</p> <p>૨૫. જાગો રે, મા-બાપ (હિંદી)</p> <p>૨૬. અડધી રાતે અજવાણું</p> <p>૨૭. અક્ષરથી આગળ</p> <p>૨૮. ખારે પ્રભુ દીદાર (હિંદી)</p> <p>૨૯. સુખે જીવવાની કળા</p> <p>૩૦. સંવેગ રંગ તરંગ ઝીલે</p> <p>૩૧. યુવા સંસ્કાર પ્રવચન</p> <p>૩૨. ચાર ગતિ કે દુઃખ (હિંદી)</p> |
|---|--|



# श्रीमति भवन

शिक्षा | शास्त्र | संदर्भ | संशोधन | समन्वय